

वर्ष १ अंक १  
अप्रिल २००७

# विहंगा

पक्षीनिरीक्षको वच्येनो सेतु



छिप्त ३, रा.

मीषा-२००७

## બદલાતો પક્રિકાર અને પંખીઓ

લાલસિંહ રાઓલ



ગયા અંકથી ચાલુ...

ખેતીમાં છંટાતી જંતુધન દવાઓથી નાશ પામેલાં કે નાશ પામનાર જંતુઅંભાવાથી પંખીઓ ઘટવા લાગ્યા. સાંજે ફરીને પાછા વળતા જે નવાપુરામાં નાના દશરથિયા (Indian Nightjar)ને ચંક ચંક ચર્ચર્ચર્ચ અવાજ મને રોજ સંભળતો તે હવે નથી. આપણો જિવાસી મોટો કાબરો ટિવાળીથોડો (Pied Wagtail)લાંની નાનકી પણ બારે માસ વહેતી નદીના ડિનારાના જે બાગને શોભાવતો તે હવે નથી દેખાતો. નીલપુંછ પતરંગો (Bluetail Bee-eater) પણ અદશ્ય થઈ ગયો છે. ભડકિયાં (Rock Bush Quail)-ની સંખ્યા ખાસી ઓછી થઈ ગઈ લાગી. પહેલા જે આંબાવાડિયામાં શૌંબિંગી (Common lora), નાચયા (Fantail Flycatcher) અને પીળક (Golden Oriole) જોવા અને સાંભળવા મળતાં, ત્યાં તેમને શોધવા રોજ જતો પણ એકેય વખત ન દેખાયા. હા, શોંભિંગી ગામભાં આવેલ વૃક્ષોમાંથી ક્યારેક સંભળતો હતો ખરો. આટલાં વરસોમાં પહેલી વાર ચાતક (Pied Crested Cuckoo) એકેય વખત જોવા-સાંભળવા ન મળ્યો. બપૈયો (Common Hawk Cuckoo) પણ માત્ર એક જ વખત સંભળાયો. પહેલા તો શોમાસામાં બે ચાર બપૈયા એ નાના ગામભાં જુદા જુદા સ્થળેથી ગાતા જ હોય. આની સામે ઘૂંકિયા (Coucal), ડાળીટેચ (Indian Robin), બલ્લાઈ (Brahminy Myna), બુલબુલ (Redvented Bulbul) અને કોયલ (Koel)-ની સંખ્યા વધી દોષ તેમ લાગ્યું.

ગામના નાના તળાવમાં પહેલાં મને કદી બતકી જોવા ન મળતી. આ વખતે નાની સિસોટી બતક (Lesser Whistling Teal) તથા તિરજા (Cotton Teal)ની બેતણ જોડી, ઝુલકી (Little Grebe) તથા કાંજિપા (Little Cormorant) દેખાયાં. આપણાં ત્રૈયે સામાન્ય કલકલિયા પણ જોવા મળી જતા. કરજશ નદીની નહેરોનું તથા વધેલા કૂવાઓ અને ટ્યુબવેલોનું પાકી મળવાથી રોકડિયા પાક તરીકે શેરડી અને કેળનું વાવેતર વધતું જ હૃદય છે. સિંચાઈની સગવડના અભાવે પહેલાં આ વિસ્તારમાં જે ક્રાંત્ય જોવામાં ન આવતા, સિંચાઈ વધવાથી ઢોર બગલા (Cattle Egret), નાના તથા વચેટ સંદેશ બગલા (Small and Median Egret) રોજ મળવા લાગ્યા.

ઇકા દામકારાં ‘મેલેરિયા નિયંત્રક’ સુનેશમાં સરકારે ધરેધરમાં ડી.ડી.ડી.નોંટકાવ શરૂ કર્યો. તેને લીધે મન્જુરો ઉપરાંત ઘરમાના ઉંદરો પણ નાશ પામવા લાગ્યા. આવા ભરેલા ઉંદરોને લોકો બહાર ફેંકી દેતા. સમયીની નજરે તે ચે એટલે ઉંદરી જાય. આવા ડી.ડી.ડી.વાળા ઉંદરો ખાવાથી તેનાં શરીરમાં ગયેલ ડી.ડી.ડી. મળ દ્વારા નીકળી જવાને બદલે તેની માંસપેશીઓમાં એકદું થાતું. પરિણામે એક સમય એવો આવ્યો કે તેનાથી સમયી મરવા લાગી. આજે ગીસેક વરસથી ત્યાં એક પણ સમયી મારા કે

અન્ય ગામવાસીઓના

જોવામાં આવી નથી. કેટલાય વિસ્તારોમાંથી તેનું અસ્તિત્વ ભૂસાઈ ગયું છે. ફક્ત મોટા શહેરો આસપાસ તે થોડી ટકી રહી છે.

**અનુકૂળાંથી પ્રવૃત્તિ**

‘સુરત નેયર કલબ’ વરસોથી સરસ પ્રવૃત્તિઓ કરતી આવી છે. “ફિંગ” ના વાયકો, પલ્લાનીરીકાંકો તથા અન્ય પ્રકૃતિપ્રેમીઓએ આ બાબતથી માહિતગાર છે. અત્યાર સુધીમાં તેણે વિવિધ પ્રકારના પ્રકાશનો કર્યા છે. તે બધાયાં શિરમોર સમું કામ છે પંખીઓના અવાજની ત્રણ કેસેટો, ચોથી કેસેટ પણ તૈયાર થઈ રહી છે. ગુજરાત રાજ્યનાં બધાં પંખીઓના અવાજ રેકૉર્ડ કરી લેવાની તેની નેમ છે. આવી કેસેટોની જરૂરિયાત વરસોથી લાગતી હતી. નેયર કલબ, સુરતે તે પૂરી પાઈને બહુ ઉપયોગી અને મહત્વાનું કામ કર્યું છે.

હમણાં એવું જ બીજું જે ઉપયોગી કામ તેણે કર્યું તે છે “જળાશયનાં પંખીઓ” અને “પંતંગિયાં” ઉપરનાં બે રંગીન પોસ્ટરો. નયનરાખ્ય છાપકાળને લીધે બંને પોસ્ટરો આકર્ષક બન્યા છે. શાખાઓનાં વિદ્યાર્થીઓને તે બહુ ઉપયોગી થઈ પડ્યે. દરેક શાખાએ આ પોસ્ટરો પોતાના પુસ્તકાલયોની ટિવાલે કાચના કબાટમાં પ્રદર્શિત કરવા જોઈએ. આમ વધવાથી તે ચિત્રો વિદ્યાર્થીઓની નજરે ચડ્યા કરશે અને તેઓ તેનાથી પરિચિત થતા રહેશે. પછી જાપાએ તેમાંનું કોઈ પંખી કે પતણિયું નંદે ચરશે ત્યારે તેને સહેલાઈથી ઓળખી શકશે. સામાન્ય રીતે જોવાં મળે તેવાં પછી જળપંખીઓ અને દર્શાવણાનાં રંગીન ચિત્રો આ પોસ્ટરોમાં આપ્યાં છે. પંખીઓનાં અંગ્રેજ અને ગુજરાતી નામો છાયાં હોવાથી તેમના વિશે વધવારે માહિતી જિજ્ઞાસુઓ સરળતાથી અન્ય પુસ્તકોમાંથી મેળવી શકશે.

આ બે પોસ્ટરો ઉપરાં “ચાલો ગીધ બચાવીએ” નામની પુસ્તિકા પણ તેણે પ્રસિદ્ધ કર્યે છે. ગીધની વસ્તીમાં ચોંડાં વરસોમાં જે કડાકો બોલી ગયો છે તેનાથી પશીનીરીકાંકો ચિંતિત છે. આવું કેમ બન્યું તે અંગેની માહિતી આ પુસ્તિકામાં અપાઈ છે. ગીધને બચાવવા શું કરવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન પણ પુસ્તિકામાં આપ્યું છે. આપણો ત્યાં જોવા મળતાં સત્તો થ જાતના ગીધનાં તેમાં આપેલા રંગીન ચિત્રોને લીધે તેમને ઓળખવાનું જિજ્ઞાસુઓને સરળ બનશે. બાંકડોને રસ લેતા કરવા માટે ગીધોનાં રંગીન ચિત્રો આપ્યા છે.

આ બધાં પ્રકાશનો બદલ ‘નેયર કલબ, સુરત’ને હાર્ટિક ધર્યવાદ.

સી-૨, હરિઓમ એપાર્ટ., ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ પ્રેસ રોડ,  
જવરાજ પાર્ક, અમદાવાદ-૫૧

## સૂચિ



બદલાતો પરિકાર	૨
વિહંગાવલોડન	૩
નિર્જિષ્ઠા નોંધ	૪
પત્રકોટુ	૧૫
પ્રાણીસંગ્રહાલયમાં પ્રજનન	૧૬
જામશાહેબનો પછીપ્રેમ	૧૮
અહલી છ્યાં?	૧૯
દરળાડાનો મારો	૨૧
મ.કુ.હિમતસિહલાની ડલામે	૨૩

### મુખ્યપૃષ્ઠ :

બાદળી દળાગોધાલો (Indian Courser)  
તસવીર : પશોધન ભાર્ટિયા, જમનગર

## સંપાદકીય



અમદાવાદની પાંચિમ સરદાની પેલે પાર, ખેતરો અને ખુલ્લી જમીન વચ્ચેના જે રસ્તાઓ ઉપર હું ચાલવા જઈ છું ત્યાંની ભૂગોળ ખૂબ જરૂરી બદલાઈ રહી છે. થોર, આવળ-બાવળની વાડો, જુવાર-તુવેરનાં ખેતરો, કાચા રસ્તાને આંકતી દેશી બાવળનાં વૃક્ષોની ઢાર વન્ય જીવોનું એક રહેકાણ બનીને ઊભાં હતાં. સસલાં, નીલગામ, ક્વાચિત્ જંગલી સુવર અને શિયાળ ઉપરાંત, તેતર, મોર અને વીડ-વગડાનાં અનેક પંખી તેમની ઢાજરી પૂરાવતાં. એકાદ-બે નાની તલાવારી અને તેમાંના ચિયા આ કુદરતી આવાસને વધુ ચેતનવંતુ બનાવતાં. શ્યામશિર ટપૂસિમા (Blackheaded Munia), થોરિયો ગંદમ (Greynecked Bunting), ડોકામરડી (Wryneck), ભડકિયું (Rock Bush Quail), વગડાઉ ટિટોરી (Yellow-wattled Lapwing), ચકવો (Common Stone Curlew) વગેરે પદ્ધીઓ ક્વાચિત્ જોવા મળી જતાં. નાચણ (Whitebrowed Fantail Flycatcher), નાનો રાચલાલ (Small Minivet), પીળક (Golden Oriole), શોબિગી (Iora) અને ગ્રીઝ - વખતમાં ખાપ્યો (Hawk Cuckoo) - ચાતક (Pied Crested Cuckoo) નિયમિત દેખાતાં કે સંભળતાં. આ જ રસ્તે મેં દેશી બાવળની જાડી ડાળીઓના ઉદ્ભબ સ્થાને વાટકી જેવો, વનકશા (Common Wood Shrike) નો મારો જોવો હતો. કૂંડીઓ, દરજા, લદેડા, બુલબુલ અને શક્કરખોરા તો તેમની ઊડાડથી સતત સંપર્કમાં રહેતાં.

આ ખેતરો બાંધકામ અર્થે વેચાઈ ગયા. વાડ ગઈ, ખેતર ગયાં, તલાવાડી અને ખાબોચિયાં પૂરાઈ ગયાં. ત્યાં સુધી તો ઢીક, કોઈ પણ કારણ વિના રાતોરાત વૃક્ષો પણ છેદાઈ ગયાં. રસ્તા પાકાં બની ગયાં છે. મફાનો ઊભાં થઈ ગયાં છે. ખાસ્ટિકનો કચરો માનવવસ્તીની ચાડી ખાય છે. હું, ‘પંખીઓ ક્યાં ગયાં હશે’ એવો વિચાર કરતો રહું છું. દેખિતું છે - માનવ વસવાટો વધશે તેમ કુદરતી આવાસો સંકોચાતાં જશે. કદાચ રસ્તાની બાજુમાં અને ખેતરને શેડે ઊભેલાં મોટાં વૃક્ષો બચાવી શકાત. ઈટ-પથરની દિવાલોને બદલે જીવંત વાડ રાખી શકાત. નવાં મકાનોની આસપાસ દેશી વૃક્ષો ઊંઘેરી શકાત. થોડી સમજણ સાથે જમીનના સોદા થાત તો જૂની તલાવાડીઓ બચાવી શકાત. પ્રકૃતિને મૂળ સ્વરૂપે ન સાચવી શકીએ છતાં કંઈક સમજણ, કંઈક સદિષ્યુતા, કંઈક સંદેનનશીલતા સાથે જીવીએ તો જેમને આપણે હંકારી કાઢ્યા છે તેમાંના કેટલાકને તો આપણે પુનઃસ્થાપિત કરી શકીએ.

આ વિષય વારંવાર મારી કલમ પર આવ્યા કરે છે, પણ હું માનું છું કે તેનું પુનરાવર્તન - દાઢીકરણ થાય એ જરૂરી છે. મારે ખાસ વાત કરતી હતી કારણ વિના ક્યારી જતાં વૃક્ષોની. મારું માનવું છે



## વિહંગ

નિમાસિક

વર્ષ-૧ સાલં અંક ૧ ચીજા ૨૦૦૭

પરામર્શક સંપાદક  
લાલસિંહ રાઓલ ડૉ. બંકુલ નિવેદી  
સહસંપાદક : નંદિતા મુનિ  
સંપાદક મંડળ  
ડૉ. પી. એસ. કકર, ડૉ. અર. બી. બલર, કે.ડી. વૈષણવ  
મુખ્યપૃષ્ઠ સંજ્ઞાવટ : મુકેશ આચાર્ય

### પત્રવ્યવહાર :

૧૮/૪૧૪, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ,  
અમદાવાદ-૩૮૦૦૧૪

E mail : vihanggujarat@yahoo.in  
trivedibakul@yahoo.com

### લાખાજામ :

વાર્ષિક : રૂ. ૧૦૦-૦૦

આજીવન : રૂ. ૧૫૦૦-૦૦

(શુભેચ્છા કણો આવકાર્ય - 'વિહંગ રીસર્ચ ફાઉન્ડેશન' - Vihang Research Foundation' નાનામે ચેક / પ્રાફિક અથવા મ.ઓ.થી)

પ્રકાશક : 'વિહંગ રીસર્ચ ફાઉન્ડેશન', ૧૮/૪૧૪,  
સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ-  
૩૮૦૦૧૪ મુદ્રક : ડૉ. બંકુલ નિવેદી, મુદ્રણસ્થાન:

ભગવતી ઓફસેટ, બંસીપદ એસ્ટેટ, દરિયાપુર  
દરવાજા બાદાર, અમદાવાદ-૩૮૦૦૦૧. લેસર  
ટાઇપ સેટીંગ : શારદ મકાનન, ૫, સનપોર્ટન્ટ  
કોમ્પ્લેક્સ, મેમનગર, અમદાવાદ ૩૮૦૦૫૨

કે, વૃક્ષ-માફિયાની ટોળીઓ ફરતી હોય છે. જે વૃક્ષ નધણિયાતું કે બીનરકિંત દેખાય તેને તેઓ ધ્યાનમાં રાખી - અનુકૂળતાએ કાપી નાખે છે. આ સંદર્ભ આસપાસના રહીશોની - સમાજની સત્કર્તા અને સાચવણી ખૂબ મહત્વનાં છે. શહેરમાં વૃક્ષો કપાય એ વાત કંઈક પચાવી શકાય - પણ ઐતરના શેડેથી કે ગામ રસ્તાની પડખેથી વૃક્ષ કપાય ત્યારે સ્વકેન્દ્રી બની રહેલાં માનવસમાજોના દુર્લક્ષ્ય, અભાવ કે નિષ્ઠિયતા પ્રત્યે દુઃખ આશ્રય થાય છે! મહોલેમહોલે, ગામેગામ, લતેલતે એવાં સક્રીય જીવ ઉભાં થવાં જોઈએ જે આવી માફિયાગીરી સામે લડત આપી શકે. શેરીનું, ભાગોળનું કે ધોરીમાર્ગ ઉપરનું વૃક્ષ પણ આપણા સૌનું છે, એ ભાવના પુનઃજિવિત કરવાની છે.

આજે જ્યારે હું કોઈ મહાવૃક્ષ જોઉં હું ત્યારે વિચારું હું કે ક્યારેક કોઈ સજજને કટલા ભાવથી એનો રોપો વાવ્યો હશે, કેટલા પ્રેમથી એને ઉછેર્યો હશે! આજીવી ૨૫ વર્ષ પછીની ધરતીને નવપલ્લવિત રાખવા આપણે આજે આવા મહાવૃક્ષો ના વાવી શકીએ? આ ચોમાસે આપણે સૌ પોતપોતાના વિસ્તારો અને શક્ય હોય ત્યાં જાહેર જગ્યાઓ ઉપર સુંદર મહાવૃક્ષો વાવીએ અને તેમનાં ઉછેરની કાળજી લેવાય તેવી વ્યવસ્થા કરીએ. વૃક્ષજ્ઞતિનું ચયન પણ સમજપૂર્વક કરીએ. જડપથી ઊળી જામ તે માટે

વાવી દેવામાં આવતાં પલ્ટુકાર્મ, ગુલમહોર, કાસીદ અને કેસિયાને બદલે આપણાં દેશી જાડ જેવાં કે, વડ, પીપળ, પીપળો, ઉમરો, મહુરો, બોરસલી, દેશી શીમળો, અરીઢા, સરગવો, કાશજો, બહેળો, અર્જુન, જંબુ, આમલી, પીલુ, ખાખરો, પનરવો વગેરે વાવીએ. દેશી વૃક્ષોમાં જીવસૂસ્થિની અસ્યાય જીતોને આશ્રય આપવાની અદ્ભુત તકાત છે. કટકેટલાં કીટકો, સરિસૂપો અને પંખીઓને આશ્રયસ્થાન મળશે! આનાથી વધુ પર્યાવરણને પ્રદાન શું હોઈ શકે?

આપ સૌ અત્યારથી જ આની તૈયારી શરૂ કરી દો. ક્યાં ક્યાં વૃક્ષો વાવી શકાય તેની યાદી બનાવો. જેટલાં મિત્રોને આ કામમાં જોતરી શકો, તેમને ભેગાં કરો. રોપા મેળવવાનો જોત વિચારી રાખો. જંગલ વિભાગની નર્સરી સુંદર દેશી વૃક્ષોના રોપા ઉછેરે છે. તેઓને તમારી જરૂરિયાત વેળાસર જીવાવો તો તમને કદાચ જરૂરી વૃક્ષજ્ઞતિઓ મેળવવામાં સહકાર પણ આપે. રોપા વાવ્યા પછી તેની કાળજી રાખવાની જવાબદારી પણ વહેંચી લો. એવી જગ્યાઓ પસંદ કરો જ્યાં તેને સ્વાભાવિક રીતે સુરક્ષા મળી રહે. આ અભિયાન આપણે સૌ આજીવી બદ્દે અત્યારથી જ શરૂ કરી દઈએ. પક્ષીનિરિક્ષણની સાથે પક્ષીસંરક્ષણ અને પક્ષીસંવર્ધનની ટિશામાં પણ યોગદાન આપીએ.



## વિહંગાવલોકન

તા. ૧૭ ફેબ્રુઆરી, '૦૭ના રોજ બેટ દ્વારકાથી લખાયેલો પત્ર :

ગઈ કાલે હું શાળાનાં બાળકો સાથે 'બોટ'માં નીકળી પડ્યો. મારો હેતુ ખાસ કરીને માન-મરૂરી ટાપુઓ પરની પીળીચાંચ ઢોંક (Painted Stork)ની માળાવસાહતની મુલાકાત લેવાનો હતો. માન-મરૂરી, એ કચ્છના અભાતના પ્રવેશદ્વાર પર પોણિનાથી પૂર્વે આવેલા ટાપુઓ છે. સમુદ્રની સપાટીથી ૫૦-૬૦ ફુટ બદાર ડોડિંગું કાઢતા આ રેતના ખડકોના બનેલા ટાપુઓ ઉપરની માળાવસાહત ગઈ સરીના નવમા દાયકામાં મેં શોખી હતી.

અમારું બપોરનું ભોજન શરૂ થયું ત્યારે માન-મરૂરીની ફરતે આવેલી પાળીની ખાડીમાં બોટ વળી. ખાડીમાં પાળીનું વહેંશ સારું એવું છે, એટલે શિયાળ (jackles) ભાગ્યે જ ટાપુની બહાર જઈ શકે. સફેદ

લવકુમાર ખાચર  
અનુ. ડૉ. બહુલ નિવેદી

કાંકડાસાર (White Ibis)ના માળાની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. ફેબ્રુ. અડધે જતાં પદ્ધતિઓ લેગા થવા માટે અને માર્યના પહેલા અઠવાયિમાં તો જોડીઓ હીડાં પર બેઠી હોય! હડક પર આજે છઅએક જોડીઓ બેઠેલી દેખાઈ. અમને ઘોતાં જ પક્ષીઓ એકબીજાની નજીક આવી ગયાં! આ માળાની વિશેષતા એ છે કે તે સીધા ખડકો ઉપર બનાવાય છે, જાડીઝાંખરા પર નહીં. સફેદ કાંકડાસારનું મજનન પૂરું થાય ત્યારે પીળીચાંચ ઢોંકનાં બચ્ચાં, મોટાં (juveniles) થઈ ગયા હોય, જેનું અવલોકન કરવાનું મારું ખાસ પ્રયોજન આ પ્રવાસમાં હતું. કોઈક કારણોસર, ટાપુ પરના જે ખડકો મુખ્ય કિનારા તરફ છે ત્યાં જ આવી માળાવસાહત બને છે. આ સિવાયના બીજા કોઈ ટાપુ પરના આવા ખડકો પર બગલા, ઢોંક કે સર્પશ્રીવ માળાવસાહત બનાવતા નથી.



જાડી અને થોરમાં ધૂસેલાં પક્ષીઓ માંડ જોઈ શકતાં હતાં.

માન-મરડીની આ મુલાકાત વખતે પીળીચાંચ ઢોકનાં મોટાં બચ્ચાં (juveniles) જાડીની ડાળીઓ વચ્ચેથી દેખાતાં હતાં. દરિયામાંથી ઉપર નજર નાખતાં હોવાથી ટાપુના કિનારે અને ખડકની ઉપર આવેલાં ધુધલિયા થોર (Euphorbia) અને તેને વિટળાયેલી જાડીની આડશમાં પક્ષીઓની ગણતરી કરવી મુશ્કેલ હતી. જાડી અને થોરની અંદર ધૂસેલાં પક્ષીઓ માંડ જોઈ શકતાં હતાં. તે સમેયે પશ્ચિમાંથી સપાટી પરનો સખત પવન શરૂ થઈ જતાં મેં બોટને, ટાપુને ફરતેં ચક્કર મરાવી બીજી તરફ લેવડાવી. આ પવનો ટાપુને અથડાઈ ઉપર તરફ જતાં હોવાથી પક્ષીઓની માળા કરવાની પસંદગી આ ટાપુઓ પર ઊતરી છે, એવું મારું માનતું છે. પવનના ઘકાથી ખૂબ સહેલાઈથી પક્ષીઓ આકાશમાં ઉપર ચરી શકે છે. ટાપુની ઉપરનાં વાદળોની ઉધ્વ ગતિથી આ પવાહો સમજ શકાય છે. ઢોક, આ ઉધ્વ પ્રવાહોની મદદથી ઊંચે ચરી, ખોરાક મેળવવા જુદી જુદી દિશામાં જતાં હોય છે. કેટલાંક તો અખાત વટાવીને કચ્છ બાજુ પણ જતાં જોવા મળે છે! પુખ ઢોક સાઢેભરની મધ્યમાં આવવાની શરૂઆત કરે છે અને ડિસેમ્બર અઠધો જતાં તો મોદેથી જોડાયેલાં પક્ષીઓ પણ પ્રજનન પૂરું કરી બચ્ચાને એકલા મૂકી નીકળી જાય છે. મારા સફનસીબે મને આ બચ્ચાના સમૂહને જોવાની તક આ પ્રવાસમાં મળી.

## નિર્બિક્ષણ નોંધ


### ભીજડિયા પક્ષી અભ્યારણયની મુલાકાત

તા. ૫-૨-૦૬ના રોજ ડૉ. સ્નેહલ પંડ્યાની સાથે ભીજડિયા પક્ષીઅભ્યારણયની મુલાકાત લીધી. વહેલી સવારે ૬-૩૦ વાગે ભીજડિયા પહોંચ્યા. તાં પહોંચ્યાતા જ વૈધાં (Rosy Pastor) નું ટોળું જાણે મોટું વાદળ હોય તેટલી સંખ્યાનું જોવા મળ્યું. ત્યાંના સૂર્યોદાય પાણીમાં સુંદર લાલ આભા પાથરી હતી. નાની દૂબકી (Dabchick) પ અહીંથી તહીં પાણીમાં દૂબકી મારી રહી હતી. આગળના ભાગમાં મોટા હજ (Greater Flamingo) નું ૭૦ થી ૮૦નું ટોળું આરામ કર્યું હતું. અમે વોચ ટાવર પહોંચ્યા તાં સુધીમાં લગભગ ૩૦૦ થી ૪૦૦ મોટા હજ જોવા મળ્યા. ગ્રષચાર ગમણા (Shoveller)નાં નર-માદા પણ

ટાપુથી થોડે દૂર રહીને, તેની લંબાઈમાં જેવી અમારી 'બોટ' પસાર થઈ, કે વેરા રાખોડી રંગનાં ૧૨૦ બચ્ચાનું ટોળું ઉંડ્યું. તેઓ પવન ભણી ઊડ્યાં અને તેને સહારે ઊંચે ગયા. મને હતું કે તેઓ હજ આ ઉધ્વ પ્રવાહમાં ઊડવાની તાલિમ લે છે અને એક-બે ચકરાવા મારી પાછા ટાપુ પર આવશે, પણ તેને બદલે તેઓ ખૂબ ઝડપથી ચકવાતની મદદથી ઊંચે ચરી ગયા અને છેક વાદળની સપાટી પાસે ચકરાવા લેવા માંડ્યા. જોતજોતામાં તો નાનાં ટપકાં જેવાં બની ગયાં! ત્યાંથી તેઓ સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિ તરફ સરકી જતાં દેખાયાં. પાછલી બાપોરનો ૪-૩૦નો સમય હતો. મેં જે જોયું તે ઢોકનાં બચ્ચાનોંને તેમનાં ભવિષ્યમાં પ્રવેશ હતો! કોઈ પુખ પક્ષી આસપાસ ન હતું. ખૂબ થોડાં બચ્ચાં, કદાચ જે સૌથી છેલ્દે હિડાંગાંથી બહાર આવ્યા હશે, તે હજ ટાપુની જાડીમાં ઊડાડી કરતાં હતાં. બેત્રા દિવસમાં તેમજો પણ તેમના ભવિષ્યની શોધ તરફ ઉડ્યન કરવું પડશે, નહીં તો ભૂખે મરવાનો વારો આવશે. આ ખડકાળ ટાપુને અફળાતા સમુદ્રમાંથી તેઓને માટે ખોરાક મેળવવો અસંભવ હતું.

મારે માટે આ એક નસીબવંતો દિવસ હતો જ્યારે હું એક પ્રજનન-ચકની પૂર્ણાખૃતિનો સાક્ષી બન્યો અને સાથે સાથે નવા ચકની શરૂઆતનો પણ!

૧૪, જયંત સોસાયરી, રાજકોટ ૩૬૪૦૦૪



તરતા જોવા મળ્યાં. ૪ કાળીપૂંછ ગડેરા (Black-tailed Godwit)ને પછીપૂંછ ગડેરા (Bartailed Godwit) પણ જોયા. બાવળમાં એક રણખુલખુલ (Whitecheeked Bulbul)ની જોડ જોવા મળી.

આગળ જતાં ટપકીલી તુતવારી (Wood Sandpiper) અને દરિયાનું પાણી વધારે ભરાયેલું હતું એ વિસ્તારમાં એક કાળીડોક ઢોક (Blacknecked Stork) ફર્ટો જોવા મળ્યો. સાથે પાણીમાં બે ચોટીલી પેણ (Dalmatian Pelican) જોવા મળી. કાંઠ પર મોટી બાટણ (Grey Plover) ૧૨ જોઈ. ચાર ઊલટીચાંચ (Avocet) પણ પાણીમાં ખોરાક શોધપતાં હતાં. ગાં પિયાસજા (Wigeon) તરતી હતી. ખેતરમાં ૬ કરકરા (Demoiselle Crane) જોવા

## નિરીક્ષણ નોંધ

મળ્યા. આકશમાં એક કપાસી (Blackwinged Kite) પાંખો ફકડાવતી એક જ જગ્યાએ સ્થિર થયેલી જોવા મળ્યા. રસ્તો પૂરો થતો હતો ત્યાં થોડો ભાગ મીઠાની છારી બાજી ગઈ હોય તેવો કડક થઈ ગયો હતો. ત્યાં નાના પતરંગ (Small Green Bee-eater) જાણો કોઈ હરિકાઈ ચાલતી હોય તેમ બાવળની ડાળીઓ પર અહીંથી તહીં ઉડાડી કરતા હતા. ક્યારેક લડાઈ થતી હોય તેવું પણ લાગ્યું, કે પછી જોડી બનાવવાની હોડમાં હોય!

આગળ બાવળની કાંટમાં એક ધોળવો ઝુમ્મસ (Tawny Eagle) શિકારની શોધમાં બેઠો હતો. બસે તરફ પાણી ભરાયેલાં હોય તેવા વિસ્તારમાંથી રસ્તો પસાર થતો હતો. અમને જોતાં જ ભગતડા (Coot) નું ૩૦૦-૪૦૦નું ટોણું પાણી પરથી ખળખલાટ કરતું ઉદ્ઘાટાયું. રસ્તામાં ઉનાની કંકણસાર (Glossy Ibis) બેઠેલી હતી, સાથે ૧ પીળીચાંચ ઢોક (Painted Stork) હતો. આગળ જતાં ૮ પીળીચાંચ ઢોક જોવા મળ્યા. બે-ત્રણ દિવાળીધોડા (White Wagtail) પૂંઢાઈ હળવતા અહીંથી તહીં ઉડતા હતા. નજીકથી પસાર થઈએ તો પણ જોડીને દૂર ન જતા કાળા કોશી (Black Drongo) પણ દસેક જોયા. એક ધોળી વાબગલી (Gullbilled Tern) કાંઠાની થાંબલી પર બેઠી હતી. દૂર બેટિયા જોવા ભાગ પર ગયણા (Shoveller) ના નર-માદા જોવા મળ્યાં. આ ઉપરાંત ૪ ગજપાઉ (Blackwinged Stilt), ૩ ક્ષુભૂત બગલા (Grey Heron), ૧ મોટો ધોળો બગલો (Large Egret), ૮ ચમચા (Spoonbill) પણ જોયા. બપોરે પાછા ફર્યા તારે રસ્તામાં ત કાળાપગ ક્રીચડિયા (Little Stint) જોવા મળ્યા. પક્ષીથી ભરબૂર ખીજડિયા પક્ષીઅભયારણની આ મુલાકાત યાદગાર રહી.

અધિકત ભષ્ટ, સ્નેહલ પંડ્યા  
ખારી, અમરેલી



### ગીર-પૂર્વમાં પક્ષીનિરીક્ષણ

તા. ૧૧-૬-૨૦૦૬ના રોજ અમરેલીના ડૉ. સ્નેહલ પંડ્યા તેમ જ જંગલ ખાતાના બીટ ગાડ્ય શ્રી ડાંગરભાઈ સાથે ગમાણિયા બીટ - ગોવિન્દપુર રાઉન્ડમાં બપોરના ઉથી રાતના ૧૦-૧૫ વાગ્યા સુધી નીચે પ્રમાણેનાં પક્ષીઓ જોયા.

ધોળાપગ બિલબટેર (Little Bustard Quail)-૧. થોરની વડમાં જતું જોયું.

કલકલિયો (Whitebreasted Kingfisher)-૨. આગળ જતાં ખોડિયારના ઘૂના પાસે ભેખડમાં માળો હોય

એવું લાગ્યું. મોમાં ખોરાક લઈને દરમાં જતો જોયો.

દૂધરાજ (Paradise Flycatcher)ની એક જોડી ઉડાડી કરી જીવાત પકડતી હતી. કદાચ એટલામાં માળો બનાવે.

અધરંગ (Tickell's Blue Flycatcher) -૪. પ્રજનન કરતી જોડી જોઈ. તેનો જુદા પ્રકારનો અવાજ પણ સાંભળ્યો.

શ્યામશિર કશ્યો (Blackheaded Cuckoo-Shrike)-૧. દૂરથી વારંવાર અવાજ સંભળાતો હતો. દૂરબીનથી જોયો.

નવરંગ (Indian Pitta) -૨. જાડીની અંદર ચાલ્યા ગયા.

કાબરો રાજલાલ (Whitebellied Minivet)-૧ તેને જોયો તે આખો વિસ્તાર કાંટાળો હતો. શ્રી ડાંગરભાઈએ જગ્યાવું કે, શિયાળામાં આ જ જગ્યા પર ૨૦ થી ૨૫ કાબરા રાજલાલનો રાતવાસો (Roosting) જોયેલો છે.

ભારતીય કુહુકંક (Indian Cuckoo) -૨. જે પક્ષી સામસામે બોલતાં હતાં. દૂર જાડની ડાળી પર હતા, પરંતુ દૂરબીનથી જોઈ શકતાં હતાં. (જુદા જુદા કુહુકંકને દેખાવથી ઓળખવા લગતભગ અશક્ય. તેમાંથી દૂર હોય તારે તો ખાસ. તેમની સાચી ઓળખ તેમના બોલવા ઉપરથી થાય તે લખવા જરૂરી છે. - લા.)

કંસારા (Coppersmith Barbet) -૩.

મોરબાજ (Crested Hawk Eagle) - ૧. આગળ જતાં વડના જાડ પરથી ઉડતો જોયો. બે-ત્રણ સીટી મારીને ચૂપ થઈ ગયો. એ જ જાડ પર એક જૂનો માળો જોવા મળ્યો.

નાના પતરંગા (Small Green Bee-eater) - ૩૦. સાંજે ઉ વાગે એક ટોણું જાડ પર રાતવાસો કરવા માટે બેદેલું જોવા મળ્યું.

ચંદ્રોદય પછી થોડો સમય આરામ કરીને આગળ વધ્યા. રસ્તામાં ડાંગરભાઈએ એક જાડ પર હરિયલ (Yellowlegged Green Pigeon)નો માળો બતાવ્યો. હરિયલ માળામાં બેઠી હતી. તેને ખલેલ ન પહોંચાડી.

એની સામેના જાડ પર એક સફેદનેણ નાચણ (Whitebrowed Fantail Flycatcher)નો માળો હતો. વિડિયો કેમેરાની લાઈટ કરીને જોયું તો માળો ખાલી હતો. પરંતુ ડાળેને સહેજ અડતાં તેમાં કંઈક ચણકતું હોય તેવું દેખાયું. ડાળ નમાવીને જોયું તો એક સાધ, કદાચ કાળોતરો (Common Krait) માળામાં ફીડલું વળીને બેઠો હતો. વચ્ચે એક ઈંદું પડ્યું હતું, બીજું કદાચ ખાઈ ગયો હશે.

## નિરીક્ષણ નોંધ

એના ફોટોગ્રાફ્સ લીધા. રાત્રે સવાદસે પરત ફર્યી.  
 અજિત ભક્ત, ડાંગરભાઈ, ડૉ. સ્નેહલ પંચચા  
 ૧, ભાવાજ, સરદારનગર-૧, નવા એસ. ટી. ઉપો પાસે, ખારી  
 જોશી બાગ, અમરેલી રોડ, ખારી તેથે ૪૧  
 ચિરંછવી હોસ્પિટલ, કેરિયા રોડ, અમરેલી તેથે ૦૧



### હનુમાનગાળાની મુલાકાત

તા. ઉ અને ૮ જૂન, ૨૦૦૬ના રોજ હું અને શ્રી નરેન્દ્ર જોટંગિયા ગીધના સર્વેક્ષણ માટે હનુમાનગાળા ગયેલા. તા. ઉમીની રાત્રિ હનુમાનગાળામાં વિતાવી. સવારમાં ઊડતાવેંત જ મોરનું નૃત્ય જોવા મળ્યું! ત્યાં લગભગ ૫૦ જેટલાં મોર અને ફેલ (Peafowl) હતાં. તે ઉપરાંત ૨૫ જેટલાં વનલેલાં (Jungle Babbler) અને ૭-૮ થોરિયા લેલાં (Common Babbler)નો કલશોર સાંભળ્યો. પીળક (Golden Oriole) પણ જોયું.

સવારના ૭-૩૦ કલાકે, હનુમાનગાળા પછાડ પર પહોંચ્યાં. અહીં ગીધનું કાયમી નિવાસસ્થાન છે, પરંતુ તે સમયે ત્યાં એક પણ ગીધ ન હતું.

અમે ત્યાંથી ૪ કિ.મી. દૂર આવેલા બગડાના માંન પર જવાનું વિચાર્યું. અહીં ઘટાટોપ જંગલ છે અને ભાડર નદીનું મૂળ છે. ત્યાં જતાં રસ્તામાં ૮-૧૫ કલાકે ચાર સફેદપાઠ ગાય (Whitebacked Vulture) ઊડતાં ઊડતાં હનુમાન ગાળા તરફ જઈ રહેલા જોવા મળ્યાં. અમારું અભિયાન સફળ થયું હોય તેવું લાગ્યું. આ ઉપરાંત રસ્તામાં ચાતક (Pied Crested Cuckoo)ની એક જોડ પાંખરતા (mating) જોવા મળી.

'બગડાનો માળ' પહોંચ્યા ત્યાં બ્રાહ્મણી કાબર (Brahminy Myna) અને ધૂકિયા (Crow - Pheasant)ને ઝગડતાં જોયાં. તપાસ કરતાં જોવા મળ્યું કે ખાવડાના વૃક્ષમાં બ્રાહ્મણી કાબરનાં બચ્ચાં છે. તે વારંવાર ચાંચમાં ખોરાક લઈને આવતી અને તે પોલાણમાં જતી જોવા મળી દૂરદૂરથી કુહુકુહ (The Cuckoo)નો અવાજ 'કુ-કુ.... કુ-કુ' એમ આવતો હતો. એક સાજડાના વૃક્ષ પર શ્યામલિર કશ્યો (Blackheaded Cuckoo-Shrike) તેના મીઠા અવાજથી ધ્યાન ખેંચતો હતો. વડના જાડ પર ચાર - પાંચ શેતનયના (White eye) ઊડાઉડ કરતી જોવા મળી. નવરંગ જોવાની ઈંચા પણ પૂર્ણ થઈ, નિરાંતે ચરતું નવરંગ (Indian Pitta) જોવા મળ્યું. પીપળાના જાડ પર બેઠેલી તૂઢી (Blossomheaded Parakeet) ચાર - પાંચ જોવા મળી. ત્રણીથી ચાર દૂધરાજ (Paradise Flycatcher) ધાસમાંની જીવાતો પકડવા

ઊડાઉડ કરતા હતા. (નર દૂધરાજના રંગ તથા પૂછુણીની વિગત લંખી હોતો સાચું થાત. -લા.)

એક બાવળમાં ધાન જતાં દૂરબીનથી જોયું તો લાલ ટપૂસિયા (Red Munia) ચારથી પાંચ જોવા મળ્યાં. ગીરમાં મેં ૧૦ વર્ષ બાદ તેમને જોયા; આનંદ થયો.

રસ્તામાં કંસારા (Coppersmith Barbet)નો એકધારો અવાજ બપોર થવાની સાથી પૂરતો હતો. વગડાઉ ભડકિયાં (Rock Bush Quail) ફર્દ... રી... રી કરતાં ઊડાં. વૃક્ષોની છાપામાં બે થી ત્રણ અધરંગ (Ticell's Blue Flycatcher) જોયા, તેમ જ સફેદનેણ નાચણ (Whitebrowed Fantail Flycatcher) પણ અહીંથી તહીં જિડી પોતાનું મધુરું સંગીત રેલાવતી હતી.

ત્યાંથી નદીના જ સસે પરત ફર્યી. રસ્તામાં એક વૃક્ષ પર ચારથી પાંચ હરિયલ (Green Pigeon) બેઠેલાં જોયાં. હનુમાનગાળાની જગ્યા પાસે પહોંચતાં બે રાખોડી રામયકલી (Grey Tit) માળાની સામચ્ચી લઈ જતી જોવા મળી. બે તિરનારી કાગડા (Jungle Crow)ને પ્રસાદનું શીપું ખાતા જોયા. ઈપડ (Magpie Robin) અને દેવયકલી (Indian Robin) તો સામાન્ય રીતે જોવા મળે જ. હનુમાનગાળાની મુલાકાતમાં આટલાં બધાં પક્ષીઓ જોવા મળ્યાં તેવી કલ્પના નહોત્તા.

અજિત ભક્ત  
ખારી



### વિવિધ નિરીક્ષણો

'વિહંગ' આવતું હતું તે પહેલાં પણ પક્ષીઓ જોવા ગમતાં. તેઓની સામાન્ય ઓળખ પડતી. નવું દેખાતું કોઈ પણ પક્ષી 'ચકલુ' કહેવાતું! રસ, જ્ઞાનમાં પરિવર્તિત ધાર્ય તેનો આનંદ અદકો હોય છે. 'વિહંગ'ના પ્રારંભથી અત્યાર સુધીના બધા જ અંકો તેની પૂરી વિગતો સાથે વાંચું છું. એની પાછળ (birdwatching માટે) ખાઈખપૂચીને પડી નથી. હજુ એટલી ઓળખ નથી, પણ ગોરા ગામે જઉ ત્યારે એની સીમમાં દેખાતાં પંખીઓ અને 'વિહંગ' તથા અન્ય ખરીદેલી ચોપડીઓ પરથી એની ઓળખ પાકી કરવાનું બને. બેરખાંગી (Indian Treepie) જાજ કરીને પરૈયું ખાવા આવે ત્યારે એનો બુલંદ અવાજ માણસવાની મજા પડે. કપડવંજની સીમમાં કાળાકોશી (Black Drongo)નાં ચુંદ દેખાય. ઘંટીટંકણો (Hoopoe) તો ત્યાંના મારા ધરની સામેના તાર ઉપર દર્શન કરાવવા આવતો! પક્ષીનોંધની વાત વાંચતી. કયારેક એવી નોંધ રાખવાનું મન પણ થતું. આ વખતે થોહુક શક્ય બન્યું.

મારા ઘરની બહાર લટકાવેલ શીકામાં હમેશાં રોટલી, ભાત, ખીચડી, ભજિયાં કે હંડવો ડોકળાં નાખ્યું. એનો લાભ લેનારા પંખીઓમાં કાલર (Common Myna), ચકલી (House Sparrow), દરજાડો (Tailor Bird), કોયલ (Koel) ( સામાન્ય રીતે જાડ પર દેખાય, પણ અહીં તો પાણી પર મજાની હંમેશાં બેસી રહે), શક્કરખોરો (Purple Sunbird), મોર (Peafowl), બુલબુલ (Redvented Bulbul), લેલાં (babblers), તેતર (Grey Partridge), કાળોકેશી (Black Drongo) વગેરે. હમજાં માટું ધાન ગંયું કે ભાત ખીચડીની શોખીન ચકલીઓ પહેલાં ૨૦-૨૫ આવતી, હવે ૪-૬ જ જણાય છે!

હેલ્લા પાંચ-છ વર્ષથી ટિટોડી (Redwattled Lapwing)ની બે જોડી આવે છે. અહીં ઈડાં મૂકે છે. બચ્યાં થોડાં મોટાં થતાં ચાલ્યા જાય છે. ઈડાં ઘણી વાર સમયી જેવા પંખી લઈ જતાં. ચાર ઈડાં મૂકાય પણ બધાં જ બચ્યાં જન્મી ન શકે. બચ્યાં આવે પછી તો સમયીઓનું રીતસરનું આકમજા હોય. પોતાના શરીરમાં ધૂસાડી એનું રક્ષણ કરતી ટિટોડીને અમે જોતાં જ રહીએ. અમારા 'કંચ્ચાઉન્ડ'માં એક ટેકરો છે. તેના ઉપર એક જોડી હંમેશાં એપ્રિલમાં આવે અને મેમાં ઈડાં મૂકે. સખત ગરૂમાં બસે નરમાદા વારાફરતી સેવ. એક ટાપકતા નણ પણે ગરમીથી અકળાઈને વારાફરતી આવે અને એ વખતે બીજી ટિટોડી સેવવા બેસે. હવે અમે પાણીની સંગ્રહ આપીએ છીએ. ક્યારા ભરી રાખીએ છીએ. પહોળા વાસ્તવામાં પાણી રાખીએ છીએ.

આ વર્ષ (૨૦૦૬) પણ એક જોડ ટેકરા પર ઈડાં સેવવા બેઠી. સમય નોંધો નથી પણ કદાચ એપ્રિલમાં જ. ચાર ઈડાં. ૧૮મેના રોજ એક બચ્યું જોયું. કલાક બાદ બીજું, બપોરે ગીજું, ચોંચું, બીજે દિવસે (૧૯ મે) સવારે જોયું. ત્રીજા દિવસ સુધી તો એમના વિકાસ પરથી પહેલું, બીજું અમ ઓળખી શકાતું. સમયીથી - કાગડાથી ભયાવા અમારો પ્રયાસ પણ હતો. છતાં ચોથે દિવસે એક બચ્યું અને પાંચમે દિવસે બીજું બચ્યું શિકાર બની ગયાં. આ બચ્યાના જન્મ બાદ, બીજી ટિટોડીની જોડ આવી ગઈ. આ જોડ આ જ સ્થળે ઈડાં મૂકતી નથી. એ તો હોસ્ટેલના પાછળના ભાગે તદ્દન જમીન પર - વૃક્ષ નીચે જ મૂકે છે. હજુ એનાં ઈડાં મુકાયેલાં જીયાં નથી. પેલાં બે બચ્યાં આજે ૮ દિવસનાં થયાં છે. ટિટોડી એને લઈને ફરવાનો બાપ વધારી રહી છે. બેત્રણ દિવસમાં જવાની તૈયારી કરશે. જવાની હોય એના આગલા દિવસે તે બોર્ડિંગના દરવાજા સુધી ઘરી ઘરી બંધ્યાં લઈને જાય છે. એ ક્યારે

ઉહી જાય છે એની ખબર પડતી નથી. આ વખતે ધાન રાખીશું.

પ્રશ્ન ધાય છે - આ જોડ જે દર વખતે આવે છે તે એની એ જ હશે કે તેનાં મોટાં થયેલાં બચ્યાં હશે?

રસીલા કરિયા

એસ.એમ.જેન બોર્ડિંગ, ટી.વી.ટાવર સામે, શાહી ઇન રોડ,  
અમદાવાદ ૩૮૦૦૪૪



### કબૂતરમાં રીસામજાં-મનામજાં?

મારી સામેના મકાનની બારી ઉપર ચારેક કબૂતર બેઠાં હતાં. તેમાં એક નર-માદાની જોડી હોય તેમ લાખ્યું. નર ધૂઘવાટ કરી માદાને રીજવવા લાગ્યો. માદા રીજાઈ ખરી. પછી તે નરે પાંખરવાનો પ્રયત્ન કર્યો પણ માદાએ જાણો કે રમત શરૂ કરી અને નરને સફળ ન થવા દીધો. થોડી સેકન્ડો નર પ્રયત્ન કરતો રહ્યો, પછી નર સામેની પાણીએ જઈને બેઠો. ત્યાર બાદ માદા જાણો કે તેને મનાવવા ગઈ પણ નરે મયક ન આપી! તે રીસાઈ ગયો હશે? (વન્ય પંખીઓમાં રીસામજાં મનામજાં હોય છે કે નહીં તેવા ડિસ્સા ખાસ જોવામાં આવ્યા નથી. એક પાળેલા પોપટના ડિસ્સામાં તેવું બનેલું ખરું. એક મિન્ઝ પોપટ પાળેલો. મિન્ઝ ઓડિસ જાય ત્યારે તેને વહાલથી બોલાવીને જાય. સાંજે આવે ત્યારે સવારની માફક તેને બોલાવે અને પછી જ બૂટ-મોજાં ઉતારે. એક સાંજે તેમ કરવાનું ચૂકી ગયા. થોડી વારે તે યાદ આવતા પોપટને વહાલ કરવા ગયા. રોજની માફક તેને પ્રેમથી બોલાવ્યો, પણ તે તો મોહું કેરવીને બીજી બાજુ જતો રહ્યો. મિન્ઝ ખૂબ મનાવ્યો પટાવ્યો, વહાલ પણ કર્યું. ત્યારે માંડતે રીઝાયો અને પૂર્વવત્તુ બોલવા લાગ્યો. તમે જડાવેલ ડિસ્સામાં નર રીસાઈ ગયો હોય તેવું લાગે છે. - લા.)

જિતુ પુરોહિત

'ચંદ્રમાલિ', સરદારનગર, કોશેદ ૩૬૨૨૨૦



### ખીજડિયામાં પક્ષીનિરીક્ષણ

તા. ૬-૬-૨૦૦૬ના રોજ ખીજડિયા પક્ષી અભ્યારણયની મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન નિહાળેલાં પક્ષીઓની નોંધ નીચે મુજબ છે.

મોટી ચોટીલી ડૂબડી (Great Crested Grebe)

૧, સર્પશ્રીવ (Darter) ૩૧, નાનો કાજિયો (Little Cormorant) ૨૩, ભગતું (Coot) ૩, શેતપંખ જલમાંજાર (Pheasant-tailed Jacana) ૧, ટીલિયાણી બતક (Spotbill Duck) ૪, ટીલિયો (Ruff and Reeve) ૮,

ખલિલી (Curlew) ૪, કબૂત બગલો (Grey Heron) ૨, નડી બગલો (Purple Heron) ૨, દરિયાઈ બગલો (Indian Ruff Heron) ૨, કાબરો કલકલિયો (Pied Kingfisher) ૧, કલકલિયો (Whitebreasted Kingfisher) ૧, મોટો ગડેરો (Blacktailed Godwit) ૪.

ક.ડ.નિમાવત



### ખીજડિયાની મુલાકાત

તા. ૨૪-૧૧-૦૬, શુક્રવારના રોજ ખીજડિયા પક્ષીઅભયારણ્ય (ધૂવાવ વોચ ટાવર તરફ)ની મુલાકાત લીધેલ. મુલાકાત દરમિયાન નિહાળેલ પક્ષીઓની નોંધ નીચે મ્રમાણે છે :

મોટી ચોટીલી ઝૂલ્ફી (Great Crested Grebe) - ૮, દૂધરાજ (Paradise Flycatcher) - ૧, નાની ઝૂલ્ફી (Little Grebe) - ૨, સર્પશીવ (Darter) - ૩૫+, નાનો કાજિયો (Little Cormorant) - ૬૦+, કાબરો કલકલિયો (Pied Kingfisher) - ૨, નકટા (Comb duck) - ૪૦+, ભગતદુ (Common Coot) - ૫૨, જલમુરધી (Common Moorhen) - ૮, સફેદછાતી સંતાકૂકડી (Whitebreasted Waterhen) - ૫, દરિયાઈ બગલો (Reef Heron) - ૧, કુજ (Common Crane) - ૧૨.

તા. ૨૬-૧૧-૦૬, રવિવારના રોજ થોળા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધેલ. મુલાકાત દરમિયાન નિહાળેલ પક્ષીઓની નોંધ નીચે મ્રમાણે છે :

ટીલિયો (Ruff) - ૧૦૦૦+, કુજ (Common Crane) - ૪૦૦+, ગાજંસ (Greylag Goose) - ૧૪૦+, ઘોળી કંકણસાર (White Ibis) - ૮, સીગપર (Pintail) - ૧૫૦+, રાખોડી કારચિયા (Common Pochard) - ૧૦૦+, ભગવી સુરખાબ (Ruddy Shelduck) - ૨૫૦+, ગયણો (Shoveller) - ૧૫+, નાની મુરધાબી (Common Teal) - ૨૦+, કાબરો કારચયા (Tufted Pochard) - ૪, નાની ઝૂલ્ફી (Little Grebe) - ૧, સર્પશીવ (Darter) - ૨, નાનો કાજિયો (Little Cormorant) - ૬૦+, મોટો કાજિયો (Large Cormorant) - ૧, નાનો કલકલિયો (Common Kingfisher) - ૧, નકટા (Comb Duck) - ૫૦+, ભગતદુ (Common Coot) - ૧૦, ચમચા (Spoonbill) - ૧૦, ટ્યુસ્ટિયુન (Whitethroated Munia) - ૧૫+, ધાનચિરિ (Pipit) - ૬.

ક.ડ.નિમાવત

૩/૪૧, સેન્ટ્રલ ગવર્નમેન્ટ કવાર્ટર્સ, નારાણપુરા, અમદાવાદ-૧૩



'ઉમરા'ના ઓવારા પર પક્ષીનિરીક્ષણ

સુરતના તાપી ડિનારાના ઉમરા ગામના ઓવારા પર નિયમિત પક્ષીનિરીક્ષણ કરી વર્ષ ૨૦૦૫માં તા. ૧૮-૫-૨૦૦૫થી ૧૮-૬-૨૦૦૫ સુધીના સમયગાળામાં નાના હંજ (Lesser Flamingo)ની તેમ જ વર્ષ ૨૦૦૬માં તા. ૬-૫-૨૦૦૬ થી તા. ૨૬-૫-૨૦૦૬ના સમયગાળામાં નાના હંજ અને મોટા હંજ (Flamingo)ની રોજેરોજની સંખ્યાની માહિતી એકત્ર કરી હતી. આ માહિતી નીચેના કોઠામાં દર્શાવી છે.

વર્ષ ૨૦૦૫	નાના	વર્ષ ૨૦૦૬	નાના	મોટા
તારીખ	હંજ	તારીખ	હંજ	હંજ
૧૮-૫-૦૫	૧૧	૬-૫-૦૬થી		
૧૮-૫-૦૫	૧૧	૧૭-૫-૦૬	૧૧	-
૨૦-૫-૦૫થી		૧૮-૫-૦૬	૨૫	-
૨૮-૫-૦૫	૧૧	૧૮-૫-૦૬	૨૩	-
૩૦-૫-૦૫	૨૧	૨૦-૫-૦૬	૨૦	-
૩૧-૫-૦૫	૨૪	૨૧-૫-૦૬	૮	-
૧-૬-૦૫	૩૦	૨૨-૫-૦૬થી		
૨-૬-૦૫	૨૮	૨૫-૫-૦૬	૨૫	-
૩-૬-૦૫	૨૪	૨૬-૫-૦૬થી		
૪-૬-૦૫	૨૭	૩૧-૫-૦૬	૨૬	૨
૫-૬-૦૫	૨૮	૧-૬-૦૬	૨૬	૫
૬-૬-૦૫	૨૦	૨-૬-૦૬થી		
૭-૬-૦૫	૨૭	૪-૬-૦૬	૮	૨
૮-૬-૦૫	૨૮	૫-૬-૦૬	૨	૧૦
૮-૬-૦૫	૨૮	૬-૬-૦૬થી		
૧૦-૬-૦૫	૨૮	૧૧-૬-૦૬	૪	૨
૧૧-૬-૦૫થી		૧૨-૬-૦૬	૫	૨
૧૫-૬-૦૫	૩૪	૧૩-૬-૦૬થી		
૧૬-૬-૦૫	૧૫	૧૬-૬-૦૬	૬	૨
૧૭-૬-૦૫	૧૧			
૧૮-૬-૦૫	૮			
૧૯-૬-૦૫	૩			

- છેલ્લાં બે વર્ષના પક્ષીનિરીક્ષણ દરમાન 'ઉમરા'ના ઓવારા પર જોયેલા પક્ષીઓ પૈકી તા. ૧૬-૬-૦૬ના રોજ અમે ૧૫ ચમચા (Spoonbill) જોયા હતા, જે બે વર્ષની નોંધમાં સૌથી વધુ સંખ્યા છે. તા. ૨૩-૫-૦૬ના રોજ અહીં અમે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓની નોંધ કરી હતી, જે નીચે મુજબ છે.

ધોળી કંકણસાર (White Ibis) ૧૫૦, પીળીચાંચ ઢોક (Painted Stork) ૨૧, દરિયાઈ બગલો (Reef Heron) ૧૦, ચમચા (Spoonbill) ૧૦, ઊલટીચાંચ (Avocet) ૩૦, ટીલિયાળી બતક (Spotbill Duck) ૪૦, ગજપાઉ (Blackwinged Stilt) ૭૦.

### દ્રેનમાથી પક્ષીનિરીક્ષણ

તા. ૨-૬-૦૮ના રોજ અમદાવાદ જતી વખતે વડોદરાથી અમદાવાદની વચ્ચે ટ્રેકની નજીક મોટા તળાવમાં આશરે ૩૦૦ જેટલાં મોટાં હંજ (Flamingo) જોયા. તે ઉપરાંત આ તળાવમાં મોટો ધોળો બગલો (Large Egret), ઢોર બગલો (Cattle Egret), કાણી બગલી (Pond Heron), ધોળી કંકણસાર (White Ibis) વગેરે પક્ષીઓ પણ જોયાં.

કેતકી અને કીર્તિ  
નેચર કલબ, સુરત

### વિવિધ સ્થળોએ પક્ષીનિરીક્ષણ

- હિંગોળગ ખાતે યોજાયેલા શિબિરમાં તા. ૨૨-૧૨-૦૫ના રોજ ભીમકૂઈ પાસે શ્રી શાનુલભાઈ ઐબલિયા અને શ્રી બાલાભાઈ સાથે પક્ષીનિરીક્ષણ કર્યું. જોયેલાં પક્ષીઓ નીચે પ્રમાણે છે.

બુલબુલ (Redvented Bulbul), કાણી બગલી (Pond heron), કબૂત બગલો (Grey Heron), નીલ જલમુરધો (Purple Moorhen), તારી અબાલી (Palm Swift), શોભિગી (Common Iora), કંસારો (Coppersmith Barbet), ખેરખુંઝો (Indian Tree pie), ધૂંક્રિયો (Coucal), સુગરી (Baya Weaver Bird), ચાપ (Roller), નાનો પતરંગો (Small Green Bee-eater), દેવકલી (Indian Robin), ઊરનારી કાગડો (Jungle Crow), હોલો (Ring Dove), તલિયો હોલો (Spotted Dove), અધરંગ (Tickell's Blue Flycatcher), હોલી (Little Brown Dove), ટિટોડી (Redwattled Lapwing), પાનપક્કાઈ (Marsh harrier), વનલેલું (Jungle Babbler), કાળો કોશી (Black Drongo), મોર (Peafowl), પચનક લટોરો (Bay-backed Shrike), જલમુરધી (Moorhen).

'પક્ષી-સંરક્ષણ મંડળ, ગુજરાત'ની વાર્ષિક સભા સમયે પરિમેજ ખાતે તા. ૧-૧-૨૦૦૮ના રોજ નિહાળેલાં પક્ષીઓની યાદી નીચે મુજબ છે.

કાળો જલમાંઝર (Bronzewinged Jacana),

લાલ ટપુસિયુ (Red Munia), ફડક ફૂટકી (Ashy Wren Wabler), રાખોડી કારચિયા (Common Pochard), વન લેલાં (Jungle Babbler), મોટો ધોળો બગલો (Large Egret), વચેટ ધોળો બગલો (Median Egret) નાનો ધોળો બગલો (Little Egret), કાણી બગલી (Pond Heron), ગયપો (Shoveller), મોટો કાજિયો (Cormorant), પાન પક્કાઈ (Marsh Harrier), નાની કંકણસાર (Glossy Ibis), કાળી કંકણસાર (Black Ibis), ધોળી કંકણસાર (White Ibis), હંતીટાંકલો (Hoopoe), સુગરી (Baya Weaver Bird), તિરજી (Cotton Teal), શૈતપાંખ જલમાંઝર (Pheasant-tailed Jacana), શક્કરખોરો (Purple Sunbird), ટિટોડી (Redwattled Lapwing), પતરંગો (Small Green Bee-eater), કાગડો (House Crow), ધૂંક્રિયો (Coucal), તારોડિયાં (Wiretailed Swallow), પીળક (Golden Oriole), ધોળી વાબગલી (Guillbilled Tern), કાળો કોશી (Black Drongo), સારસ (Sarus Crane) ૨ પુખ અને ૨ અપરિપક્ય એમ કુલ ૪, નીલ જલમુરધો (Purple Moorhen), રણ બુલબુલ (White-cheeked Bulbul), ઊરનારી કાગડો (Jungle Crow), નાની ઝૂબકી (Little Grebe), ઢોર બગલો (Cattle Egret), દૂધિયો લટોરો (Grey Shrike), પચનક લટોરો (Baybacked Shrike), શાઠીચાંચ ઢોક (Openbill Stork), કલકલિયો (Whitebreasted Kingfisher), કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher), પીતશિર પીળકિયો (Yellowheaded Wagtail), બુલબુલ (Redvented Bulbul), નીલ બગલો (Purple Heron), ભગતંતુ (Coot), ગજપાઉ (Blackwinged Stilt), નીલકંઠ (Bluethroat), પાન ફડકફૂટકી (Plain Wren Warbler), લુદાર (Gadwall), પિપસણ (Wigeon), વૈયું (Rosy Pastor), ગાજંસ (Greylag Goose), નાની ઝૂબકી (Little Grebe), કાળીડોક ઢોક (Blacknecked Stork), ભગવી સુરખાબ (Ruddy Shelduck), કેચીપૂંછ તારોડિયું (Redrumped Swallow), ચેતવા (Garganey).

આ પક્ષીઓ ડૉ. ઈન્દ્ર ગઢવી, શ્રી દુષ્પંતસિંહ જાલા તથા શ્રી દર્શનભાઈ સાથે નિહાળેલાં.

- તા. ૨૨-૧-૦૮ના રોજ શ્રી પી. પી. ડોડિયા તથા શ્રી લાહુમોર સાથે મહુવાથી ૧૫ ક્રિ.મી. દૂર આવેલ

સમાચારજીના બંધારામાં નીચે પ્રમાણેનાં પક્ષીઓ નિહાળ્યાં:

નાનાં હંજ (Lesser Flamingo) ૧૩૪, ગુલાંબી પેશ (Rosy Pelican) ૨૮, ભગતં (Coot) ૨૫૦+, કેંચીપુંજ વાબગલી (Indian River Tern) ૩૮, લડાખી ઘોમડા (Brownheaded Gull) ૭, ચમ્ચા (Spoonbill) ૬૨, મોટો કાજિયો (Large Cormorant), કાણી બગલી (Pond Heron) ૮, ટિટોરી (Redwattled Lapwing) ૨૫, રાખોરી કારચિયા (Common Pochard) ૧૦ થી ૧૫, ભગવી સુરખાબ (Ruddy Shelduck) ૭૫, નાનો કાજિયો (Little Cormorant) ૧૭, દરિયાઈ બગલો (Reef Heron) ૩, નાનો ધોળો બગલો (Little Egret), મોટો ધોળો બગલો (Large Egret) ૪, ગયણો (Shoveller) ૨૫૦+, નાની ઝૂબકી (Little Grebe) ૨૫૦+, પિયાસજા (Wigeon) ૪૦, લુહાર (Gadwall) ૨૫૦+, ગજપાઉ (Blackwinged Stilt) ૨૦, નાની મુરઘાબી (Common Teal) ૪૦૦, પીળીચાંચ ઢોક (Painted Stork) ૨૮, પીળકેયા (Yellow Wagtail) ૭, કાળી કંકલસાર (Black Ibis) ૨૦, દોંગીલી (Sand Plover), કંદલાવાળી નાની દોંગીલી (Little Ringed Plover) ૧૦, વણાચોળખાયેલા ગડેરા (Unidentified Godwit) ૨૫૦, નકટા (Comb Duck) ૨૦, નીલ જલમુરધો (Purple Moorhen) ૩, કાણપગ ક્રીચાડિયો (Little Stint) ૧, દરિયાઈ તુતવારી (Terek Sandpiper) ૫, નાનો લીલાપગ (Marsh Sandpiper) ૫, સીંગપર (Pintail) ૮૦, કબૂતર બગલો (Grey Heron) ૫, કાળું વૈંધુ (Common Starling) ૩, પાનપણાઈ (Marsh Harrier) ૧.

- તા. ૨૮-૧-૦૬ના રોજ મહુવાથી ૧૮ ક્રિ. મી. દૂર આવેલ નિકોલ બંધારા પર શ્રી પી. પી. હોડિયા સાથે નીચે મુજબનાં પક્ષીઓ નિહાળ્યાં:

સીંગપર (Pintail) ૮, નકટા (Comb Duck) ૭૦, મોટો કાજિયો (Cormorant) ૧૪, ચમ્ચા (Spoonbill) ૩૦, મોટો ધોળા બગલો (Large Egret) ૩, ગયણો (Shoveller) ૩૦, નાની મુરઘાબી (Common Teal) ૨૦, ટીલિયાળી બતક (Spotbill Duck), કુંજ (Common Crane) ૪૦૦, ખલિલી (Curlew) ૨, પિયાસજા (Wigeon) ૫૬, ભૂલામણી દોંગીલી (Kentish Plover) ૫, મોટો ચકવો (Great Stone Curlew) ૨, દરિયાઈ બગલો (Indian Reef heron)

૨, નાની ઝૂબકી (Little Grebe) ૧, કાચબરંગી (Turnstone) ૧૨, નીલ જલમુરધો (Purple Moorhen) ૫૦, સરેદછાતી સંતાકુકરી (Whitebreasted Waterhen) ૧, પીળીચાંચ ઢોક (Painted Stork) ૧, વણાચોળખાયેલ તુતવારી (unidentified Sandpiper), વણાચોળખાયેલી દોંગીલી (unidentified Sand Plover), પાનપણાઈ (Marsh Harrier).

દિશા, હેતલ, અન્નપૂર્ણા, રુચિ દવે  
ગર્વસ લાઈસ્ક્લાન્ડ, તાજાજા



### ગરમાળાનું ઝાડ અને પાણીની પરબડી

મારા ધરના આંગણામાં ગરમાળાનું ઝાડ છે.

અત્યારે (તા. ૧૫-૫-૦૬ના રોજ) સવારે તેના પીણાં ફૂલો મારા ધરની શોભા વધારી રહ્યાં છે. આ ઝાડ પર મેં પાણીની પરબડી અને પંખીઓના ચણ માટે છાબડી બાંધેલી છે. આ ચણ ખાવા બુલબુલ (Redvented Bulbul), લેલાં (Babbler), કાબર (Common Myna), ચકલીઓ (House Sparrow) અને અનેક નવાં નવાં પક્ષીઓ આવે છે. કબૂતર સુદૂં ત્યાં આવે છે. જિસકોલી પણ પુંછું ઊંચી નીચી કરતાં રોટલીના બટકાને ઉભડક બેસી બે પગના પંજામાં પકડી 'કરર કરર' કરતાં ખાતી હોય છે.

વચ્ચે એક ખેરબંદો (Treepie) પણ તેના ધારદાર ઘોખરા અવાજથી બંડ પોકારતો આવતો. સવારના પહોરમાં મને પરાણે ઉઠાડે જ છૂટકો કરતો, કારણ કે હું જાગું તો જ તેને ખાવાનું મળે તેવી સમજદારી ભાઈની! પણ હમજાં હમજાં આ ભાઈ દેખાતા નથી. કેમ? કોને ખબર?

બે ત્રણ અઠવાડિયે પાણીની પરબડી સાફ કરું છું. તેમાં લીલ જામી જાય છે. (બેત્રણ અઠવાડિયે નહીં, બે-ત્રણ દિવસે સાફ કરો તો સારું. - લા.)

પંખીઓ જોવાની મજા પડે છે. બુલબુલ બહુ ચંચળ, કાબર, લેલાં નિરાંતવાળા. કબૂતર અને જિસકોલી થોડોઘણો અવાજ સાંભળી ભાગે.

અત્યારે તો ગરમાળાના ઝાડ પર પુષ્ટ ફૂલો હોવાથી સવારના પહોરમાં ભરમાનો ગુંજારવ એવો સરસ સંભળાય છે કે મજા આવી જાય!

મારી એવી ટેવ છે કે સવારના જાગું એટલે તરત જ પરબડીમાં પાણી ભરું. પછી રોટલી-રોટલા છાબડીમાં નાંખું, ચોળીને સ્તો. કબૂતરને ફળિયામાં ચણ નાંખું. પછી જ દાતજ પાણી. આમ કરવાથી મનમાં શાંતિ અને સંતોષ મળે છે.

ગોવિદભાઈ બારેયા  
ખાખરિયા (ખોડિયાર મંદિર), તા. શેહાર, કિ. લાવનગર



## યજ્ઞમાન માબાપ

નણસરોવર ચેકપોસ્ટ પાસેના કવાર્ટસના આંગણામાં વનલેલાં (Jungle Babbler)ના ટોળા સાથે ફરતું એક ચાતકનું બચ્ચું, પણ કદમાં લગભગ પુખ જેવું - અપુખ ચાતક કહી શકાય, તે જોવા મળ્યું. લલેડાં આ ચાતકને ખોરાક ખવડાવતા હતાં. માળા માટે પરોપજીવી (nest parasites) ચાતકનાં યજ્ઞમાન પક્ષીઓમાં લલેડાં મુખ્ય/મોખ્રે છે. લગભગ પાંચ વર્ષના સમયગાળા બાદ આ પ્રકારે લલેડાં વચ્ચે ચાતકનું બચ્ચું જોવા મળ્યું. સમય ૧૫-૩૦, તા. ૨૮-૧૦-૨૦૦૬.

ઉદ્ય વોરા

૧૬૮, સ્વિટ હોમ એપા., સેક્ટર ૨૮, ગાંધીનગર ૩૮૨૦૨૮



## કાગડાની કરામત

પક્ષી જગતની દંતકથાઓમાં કહેવાય છે કે કાગડો એ સૌથી ચતુર પક્ષી છે અને કાગડાની ચતુરાઈ આગળ દુનિયાનાં બધાં જ પક્ષીઓ પાંગળા છે. તા. ૧૫-૬-૦૫ના દિવસે મેં પ્રત્યક્ષ નિહાજેલો એક બનાવ આ દંતકથાની સાક્ષી પૂરે છે. તે દિવસની સમીક્ષાંજે ૬-૪૦ વાગ્યે નણસરોવર પક્ષીઅભ્યારણ્યની ચોકડી પાસેથી હું નણસરોવર તરફ પ્રયાણ કરતો હતો. અચાનક મારી નજર એક બાજુ પર પડેલી સાયકલ પર ગઈ. ધ્યાનથી જોતાં માલૂમ પડ્યું કે, સાયકલના પાછલાં કેરિયર પર સખત રીતે બાંધેલી કાથીને એક કાગડો ખોલવા મથતો હતો. મારા અનુમાન અને અનુભવ મુજબ એક પક્ષી માટે આ એક તદ્દન અશક્ય કામ હતું. છતાં પણ મારા આશર્ય સાથે ઘણી મહેનતને અંતે (૧૦-૧૫ મિનિટ) કાગડાએ કાથી ખોલીને અશક્ય કામ કરી બતાયું. કાથી ખોલ્યા બાદ, ચાંચ અને નહોરની મદદથી કાગડાએ કાથીના તાંત્રણાઓ ઉકેલવા માંડયાં. લગભગ તુ ફૂટ જેટલી લાંબી કાથીને સંપૂર્ણપણે ઉકેલ્યા બાદ કાગડો, પાસે આવેલ એક પાણીના ખાબોચિયા પાસે કાથી લઈ ગયો. ત્યાર બાદ, તે કાથીના તાંત્રણાને વારાફરતી પાણીમાં બોળીને પાસે આવેલા લીમદાના જાડ પર લઈ જતો હતો. સાવચેતીપૂર્વક (કાગડાને ખ્યાલ ન આવે તે રીતે) લીમદાના જાડ પાછળ જઈને હું ઊભો રહ્યો. થોડી વારમાં કાગડાની ચતુરાઈનું પ્રદર્શન છતું થયું. ધ્યાનથી જોતાં માલમ પડ્યું કે, તે લીમદાના જાડ પર કાગડાનો માળો હતો અને તે માળામાં કાગડો એક પછી એક પાણીમાં પલાણેલા કાથીના તાંત્રણ મૂક્તો ગયો. આમ લગભગ ૩૦ થી ૩૫ મિનિટ સુધી ચાલ્યું. સમગ્ર ઘટનાને અંતે કાગડાએ તે માળામાં વિશ્રામ લીધો. ‘બાયનોક્યુલર’ની મદદથી જોતાં જણાયું કે,

કાગડાનો માળો લીમદાની સૂકી ડાળીઓ તેમજ નાળિયેરના સૂકી રેસાઓથી બનેલો હતો.

આ સમગ્ર ઘટનાનું અવલોકન કર્યા બાદ હું એ નિર્જર્ખ પર આવ્યો કે, ઉનાળાની આ કાળજાળ ગરમીથી બચવા કદાચ કાગડાએ આ કરામત કરી હોય. ભીની કાથીના સહારે તે માળામાંનું વાતાવરણ ભેજવાનું રાખી શકે અને અસંખ્ય ગરમીમાં થોડી રાહત મેળવી શકે.

## - જોડી બનાવવામાં હરિઝાઈ

તા. ૧૦-૭-૦૬ના રોજ સવારે ૧૧-૩૦ વાગે હું નણસરોવર પક્ષીઅભ્યારણ્યના પ્રવેશદ્વારની સામે આવેલાં ‘શ્રીનિપાઈ’માં બેઠો હતો. અચાનક લીમદાના જાડ પરથી કોઈક પક્ષીનો વિચિત્ર અવાજ સંભળાયો. ધ્યાનથી જોતાં માલૂમ પડ્યું કે, તે પીળક (Golden Oriole) હતાં. કુલ નાશ પીળકમાંથી બે માદા અને એક નર હતાં. શરૂઆતમાં હું આ સમગ્ર ઘટનાથી અજ્ઞાત હતો, પરંતુ થોડી વાર બાદ મને લાગ્યું કે પીળકની જોડીમાંના નર તરફ એક બીજી માદા આકાર્ષણી હતી, જે નરની નજીક આવવા પ્રયત્ન કરતી હતી. જેથી નર સાથે હંમેશા રહેતી માદા બહારથી આવેલી માદા સાથે જઘડતી હતી. તેની આ વર્તણું લગભગ ૧૦ થી ૧૫ મિનિટ સુધી અવિરતપણે ચાલ્યું રહી, જે દરમિયાન મૂળ માદાએ બહારથી આવેલી માદાને ચાંચો મારીને સખત ઘાયલ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના પીળકનો નર મૂક બનીને નિહાળતો રહ્યો. અંતે બહારથી આવેલી માદા થાકીને, હારીને, શિયિયારી પાડતી તે સ્થળ છોડી ગઈ.

## - વગડાઉ બિલાડો અને કાળી કંકણસાર

તા. ૧૭-૮-૦૬ના રોજ સાંજે ૬-૧૦ વાગે વેકરિયા ગામ તરફથી નણસરોવર પક્ષીઅભ્યારણ્ય તરફ હું આવતો હતો. થોડે દૂર ચાલતા એક વગડાઉ બિલાડાને રસ્તા પરથી પસાર થતો જોયો. ધીમે ધીમે તે નજીક આવેલા ગુલમહોરના વૃક્ષ પર ચરી ગયો. કુતૂહલવશ હું થોડી વાર ત્યાં થોબી ગયો. જોયું તો, જાળી ટોચ પર કાળી કંકણસાર (Black Ibis)નો માળો હતો, જેમાં તે બેઠી હતી. સાથે એક બચ્ચું પણ હતું. કાકણસારને ખબર ન પડે તેમ વગડાઉ બિલાડો ધીમેથી તેના માળા સુધી પહોંચી ગયો અને બચ્ચાને પકડી લીધું. પરંતુ આ જોતાં જ કંકણસારે બિલાડાને ચાંચ મારવાનું શરૂ કરી દીધું. જેથી સતત ચાંચોના પ્રહારથી બિલાડાએ બચ્ચાને છોડી દીધું અને બચ્ચું જમીન પર પરીને મરી ગયું. વિફરેલા બિલાડાએ પોતાનો હથમાં આવેલો શિકાર ગુમાવી દેતા મૌખાં આવેલો કોળિયો ઝૂટેવાઈ જવાની આકસ્મેક લાગળી સાથે કંકણસાર પર વળતો પ્રહાર કરીને

તેને પણ સખત ઘાયલ કરી. થોડી વારની લડાઈ બાદ બિલાડાએ કાળી કંકણસારને મોતને ઘાટ ઉત્તરી દીધી. મૃત કંકણસારને મોંગમાં લઈને ત્યાર બાદ તરત જ આડ પરથી નીચે ઊતરીને વગડા તરફ વાટ પકડી.

ઉપરોક્ત ગ્રણેય ઘટનાઓ સંબંધિત મારાં વિચારોને એક લેખરૂપી ઓપ આપવા તેમજ કંડારવા માટે હું શ્રી હિરેન સોની (પક્ષીનિરીક્ષક, આણંદ)નો ફદ્યપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.

### કાસમ સમા

નળસરોવર પક્ષીઅભયારણ્ય

મુ.પો. વેકરિયા, તા.આણંદ, જિ. અમદાવાદ

**સુરતની આજુબાજુનાં પક્ષીઓની નોંધ**  
 ૨૦-૮-૦૬ના રોજ સુરતની કરીમાબાદ સોસાયટીની આસપાસના આકાશમાં ૭૦૦ જેટલી સમરી જોઈ, જે દર એકાદ બે વર્ષ નિયમિત ચોમાસામાં જોવા મળે છે. આ વખતે દાંડી રોડ (સુરત) પર એક જ જગ્યાએ જલમુરધા (Water Cock)નો અવાજ ર જુલાઈએ સંભળાયો. એ સિવાય ક્યાંય જોવા મળ્યા નહિ. સુરંગી પાનબગલી (Chestnut Bittern), પીળી પાનબગલી (Yellow Bittern), ૨ - ૨ જોવા મળી. ચોમાસા દરમ્યાન તા. ૧૦-૧૧-૦૬ના રોજ હુમસ ખાતે રાખોડીશર મેના (Greyheaded Myna) ૧૦, એક સાથે સૂકા ઝડ પર જોઈ જે અગાઉ ડો. બફુલ ચિવેદીએ ર વખત અહીં નોંધી હતી પણ મને ખૂબ રજણપાટ કરવા છતાં જોવા મળી ન હતી. કાબરા પીદા (Pied Bush Chat)ની માદાને હુમસના રસે જીવત પકડતા નજીકથી જોઈ. ચટકી માખીમાર (Redbreasted Flycatcher) આ વખતે સહજ જોવા મળે છે. સુરત ખાતેના સ્નેહલભાઈના ફર્મમાં ૨ નર અને ૩ માદા જોઈ.

૭-૧૧-૦૬ના રોજ ડાંગની મુલાકાત લેતા, ગ્રણ નર શામા (Shama) સાથે જોઈ, તેમાં એક, દૂરથી માદા સાથે સૂર પૂર્યાવતો ગાતો જોવા મળ્યો. ૨ રાખોડી ચિલોત્રા (Grey Hornbill) જોયા. એક કીરીધર લક્કડખોડ (Rufous Woodpecker) કે..કે..કે.. કરતો સરસ ઊડતો નીકાંયો અને એક લાલપીઠ સોનેરી લક્કડખોડ (Larger Golden Woodpecker) જબરજસ્ત અવાજ કરતો ૧૦ ફૂટ નજીક થડ પર આવાને બેસીને ઊરીને જતો રહ્યો.

મુકેશ ભડ્ક

સારસ, ૧૦૧, ધરતીએપાર્ટ, પાસે, ચંદન પાર્ક સામે,  
સીટીલાઈટ રોડ, સુરત ૩૮૫૦૦૭



## અમદાવાદ પાસે બગલાની માળાવસાહિત

અમદાવાદ શહેરથી લગભગ દસેક ડિ.મી.ના અંતરે સાણંદ તાલુકાનું ગોધાવી ગામ આવેલું છે. તા. ૧૨-૧૧-૨૦૦૬ના રોજ અમે 'પરમ અમદાવાદ'ના અન્યથે (લાલસિહદાદા, બફુલભાઈ તથા અન્ય મિશ્રો) બધાં ગોધાવી ગામ (બોપલ-ઘૂમા રોડ પર આગળ જતાં જમણી બજુ)ના સીમતળાવ પર પક્ષીનિરીક્ષણ માટે એકંઠાં થયાં હતાં. તળાવનાં ધોબીવાટ પાસે આવેલાં દેશી બાવળ પર ફાટીચાંચ ઢોંક (Openbill Stork)ના ત૦ થી વધારે માળા આવેલા હતા, જેની આસપાસ ફ૫ જેટલા ફાટીચાંચ ઢોંકના મોટાં બચ્ચાં (Juvenile) જોવા મળ્યા. માળાની સંખ્યા અને મોટાં બચ્ચાંની સંખ્યાનું પ્રમાણ જોતાં આ સ્થળ ખૂબ જ મહત્વાનું ગણી શકાય, આ ઉપરાત ધોળી કંકણસાર (White Ibis) - ૧૮, ફાટીચાંચ ઢોંક - પુખું ૪૫, વચેટ કાજિયા (Indian Shag) - ૩૮, સર્પશ્રીવ (Darter) - ૧, નાનો ધોળો બગલો (Little Egret), ઢોરબગલો (Cattle Egret), નાનો કલકલિયો (Common Kingfisher), સફેદછાતી કલકલિયો (White-breasted Kingfisher), મોટો ધોળો બગલો (Large Egret), કાણી બગલી (Pond Heron) જોયા.

ખાસ નોંધ : ફાટીચાંચ ઢોંકની આ બગલા વસાહત સારા વરસાને કારણે, આ સ્થળ પર છેલ્લાં બે વર્ષથી છે, એમ ગામલોકોનું કહેવું છે. બે વર્ષ પહેલા કોઈ વસાહત ન હતી.

દિશાન્ત પારશર્ય, જનકી તેલી  
૧૮૬/૨, સેક્ટર ૨૩૧, ઇન્ડિસીટી પાસે, ગાંધીનગર



## અબાબીલ (House Swift)ના માળામાં મૃત ચકલી

તા. ૧૬-૮-૨૦૦૬ના રોજ નારાયણ સરોવર (૨૧° ૪૩' ઉ. ૬૮° ૩૩' પૂ.) પક્ષીનિરીક્ષણ માટે જવાનું થયું. સરોવરના મુખ્ય મંદિરમાં ૧૨ ફૂટ ઊચા ગુંબજમાં અબાબીલના માળા જોયા. દસથી બાર અબાબીલ માળામાં આવજા કરતી હતી.

બે કાણાંમાંથી બચ્ચાં ડોકાં કાઢતાં જોવા મળ્યાં. પક્ષીઓ ખોરાક લઈને આવતા હોથ તેવું લાગ્યું. કોઈ પક્ષી માળામાં અહીં મિનિટ રોકાનું તો કોઈ પક્ષી માળા પાસે માત્ર ચાંચ અડાડી ચાલી જતું. આમ પક્ષીની આવજા અને તેનું 'ઝીન ઝીન' સંગીત વાતાવરણને જીવત બનાવતું હતું.

## નિર્દેશિત નોંધ

માળા બનાવવામાં પક્ષીનાં નાનાં પીંડાં જીણી સાંઠકડી અને માટીનો (ઉપયોગ કર્યો હોથ તેવું લાગતું હતું. પરંતુ આશ્રય ત્યારે થયું કે, માળા બહાર એક મૃત ચકલી જોવા મળી. ચકલીના પગ માળામાં ફસાયેલા લાગ્યા. ચકલીને માળા પાસે આવવાનું કારણ શું?

માળામાંથી પોતાના માળા માટે સામગ્રી લેવા આવી હશે? અબાબીલના બચ્ચાને મારવા આવી હશે? ચકલીનું મૃત્યુ થવાનું કારણ શું?

એ જ ટિવસે દરિયા ડિનારે જોવામાં આવેલા બીજાં પક્ષીઓની નોંધ : પીળીચાંચ ઢોંક (Painted Stork) - ૧૨ (ઉડતાં જોયા), કાળીડોક ઢોંક (Blacknecked Stork) - ૨, નાની વાખગલી (Little Tern) - ૧૨, ખલિલી (Curlew) - ૧, મોટો બગલો (Large Egret) - ૧, નાની તુતવારી (Common Sandpiper) - ૨, કબૂત બગલો (Grey Heron) - ૧.

### અચ્છિન પોમલ

પોમલ જ્યેલર્સ, વોકળા ચોક, ભુજ-કચ્છ ૩૭૦૦૦૧



### ગીરની મુલાકાત

તા. ૨-૧૦-૦૬ના રોજ ગીરની મુલાકાત લેવાનું બન્યું. હું અને રવિ સતાખારથી સાસણ થઈ જામવાળાના રસ્તે પસાર થયા. જોયેલાં પક્ષીઓ :

ચોટલિયો સાપમાર (Crested Serpent Eagle), મધ્યિયો (Honey Buzzard), શૈતનયના (White Eyes), મોરબાજ (Crested Hawk Eagle), તલિયું ટપુસિયું (Spotted Munia), દૂધરાજ (Paradise Flycatcher), અધરંગ (Tickell's Blue Flycatcher), કંઈલો ચુંગાડ (Collared Scops Owl), ખેરો (Scavenger Vulture), શ્યામશિર શૈતકંઠ (Orphean Warbler), થરથરો (Black Redstart). (Scops Owl કુદરતમાં ઓળખવા અધરાં છે. ધર્મકુમારસિંહજી તેમના Scops 'Owl are difficult' માં લખે છે 'The various races of Scops Owl are difficult to identify in the field.' લખાણમાં Scops Owlના ઉલ્લેખ પાછળ કૌંસમાં (?) મશ્રાર્થ ચિહ્ન મૂકું જરૂરી. - લા.)

### રાજદીપ જાલા, રવિ આરદેશકા

૩૮/બી, પર્સ્કુટીસો., એસ્ટ્રોન સો. સામે, કાલાવડ રોડ, રાજકોટ - ૧  
રવિ, ૭૭, જનકપુરી સો. યુનિ. રોડ, રાજકોટ ૩૬૦૦૦૭



### વાંકાનેર થાન પાસે પક્ષીનિરીક્ષણ

- તા. ૨૪-૧૧-૦૬, સ્થળ : ખેરવા ગામનું

તળાવ, વાંકાનેરથી ૧૦ કિ.મી., સમય સવારે ૧૧ વાગ્યે.

ભગવી સુરખાબ (Brahminy Duck) - ૨૨, નિરજ (Cotton Teal), સિંગપર (Pintail), ગયણો (Shoveller), મોટો કાજિયો (Large Cormorant), નાનો કાજિયો (Little Cormorant), ભગતું (Coot), પીળીચાંચ ઢોંક (Painted Stork), કબૂત બગલો (Grey Heron), સફેદ પેણ (Rosy Pelican), ગારખોદ (Snipe), ટીલિયા (Ruff), પાન્ચહાઈ (Marsh Harrier), કપાસી (Blackshouldered Kite) પ્રણયચેષા Courtship Display), શકરો (Shikra), લરજી (Kestral), કેંચીપુંછ વાખગલી (River Tern), નાની તૂતવારી (Common Sandpiper).

- તા. ૨૪-૧૧-૦૬, સ્થળ : બાંડિયાબેલી - માડવ વીડ, થાન, સમય : બપોરે ૩ વાગે.

તરવરિયો માઝીમાર (Greyheaded Flycatcher), થરથરો (Redstart), મધ્યિયો (Honey Buzzard), લરજી (Kestral), નાનો રાજલાલ (Small Minivet), કપાસી (Blackshouldered Kite).

- તા. ૨૪-૧૧-૦૬, સ્થળ : વાંકાનેરથી થાન જવાના રસ્તે, સમય બપોરે ૨ વાગે.

સારસની એક જોડ રસ્તાથી સાવ નજીક જોવા મળી. સ્થાનિક ખેડૂતના કહેવા મુજબ લગતબા બારે માસ જોવા મળે છે.

ધૈરત હાથી, રાજદીપ જાલા



### ઉભાડા વીડીની મુલાકાત

તા. ૮-૮-૦૬, શુક્રવાર, સ્થળ : ઉભાડા વીડી, ગોડલ, સમય : સવારે ૮ થી ૧૨. જોયેલાં પક્ષીઓ :

ટેક્ષાર્પરી (Wryneck) - ૧ જોડી, વર્ષા લાવરી (Rain Quail), તલિયોતેતર (Painted Partridge), પાન્ચહાઈ (Marsh Harrier) ૩, કપાસી (Blackshouldered Kite), કાબરો કલકલિયો (Pied Kingfisher), ટીલિયાળી બતક (Spotbill), ભગતું (Coot), નાની દૂબકી (Little Grebe).

અશોકાદાઈ મશરૂ અને પજેશભાઈ દવે પણ સાથે હોવાથી વધારે મજા આવી.

ધૈરત હાથી, રાજદીપ જાલા ૧/૧૦, એસ્ટ્રોન સો., અમીન માર્ગ, કાલાવડ રોડ, રાજકોટ - ૧



## પત્ર-સેતુ

### ■ માન્યતા કે હકીકિત?

‘વિહંગ’ સંનંગ અંક રદ્દના પાન ર ઉપર આદરણીય મુ. શ્રી લાલસિંહભાઈનો લેખ ‘માન્યતા કે હકીકિત?’ ખૂબ રસ્પદ છે. કાળાકોશીના ગાન માટે તેમણે છેલ્લે ‘મૂડ’નો પ્રશ્ન કર્યો છે. મેં જે સાહિત્ય વાંચ્યું છે તે મુજબ, કેટલાંક પક્ષીઓ નકલખોર હાય છે, જે પૈકી કાળોકાશી એક છે. કાળોકોશી, કેટલાંક પક્ષીઓ અને તેની આસપાસના કેટલાંક પ્રાણીઓના અવાજની પણ નકલ કરતો જાણ્યો છે. પ્રશ્ન એ છે કે કાળોકોશી શા માટે નકલ કરતો હશે? આ બાબતમાં આધારભૂત ‘હાઈપોથીસીસ’ એવી છે કે કાળોકોશી તેની સાથે તેના વિસ્તારમાં હસ્તિફાઈ કરી શકે તેવા કોઈ પક્ષીની હાજરી જાણતાં જાતજ્ઞતના આવા અવાજોની નકલ કરી કદાચ હરીફને ભગાડી મુકવાનો પ્રયત્ન કરે છે. કારણ જે હોય તે પરંતુ તે જબરો નકલખોર છે તે સાચું છે. કાળોકોશી કેટલાક ગાયક પક્ષીઓના ગાયનને એકી બેઠકે ગાઈને આપણું દિલ ડોલાવે એવું બની શકે છે.

દૈયડનું ગાન રેકર્ડ કરી જો ટેપને દૈયડના વિસ્તારમાં ‘રીલે’ કરવામાં આવે તો તે દૈયડ, સામે તેનો જવાબ દેવા માટે જુગલબંધી કરે. કાળાકોશી-દૈયડની જુગલબંધી બાબતે આવું શક્ય છે, કે કાળોકોશી દૈયડની નકલ કરે અને દૈયડ તેને (બાજો દૈયડ સમજી) ચેલેન્ઝ કરે અને ગાય.

અહીં દૈયડ કાળાકોશીને ગાતો જુએ એટલે ‘અરે આ તો દૈયડ નથી’ એવો તક ન કરે. એ તક માત્ર માનવ સુસંગત છે, દૈયડ તો ‘ટેપ’નું ‘રીલે’ હોય કે કાળોકોશી, તેને માટે માત્ર ગાન જ અગત્યનું છે. આવું જ તમરાં, કસારી વિગેરેના ગાન ટેપ કરી, રીલે કરીને જોઈ તથા સાંભળી શકાય છે.

પ્રજનનકાળમાં નર દ્વારા પોતાની સરહદ માટે ગાન, ઉફુન અને શારીરિક અંગલંગીઓ દ્વારા પોતાની જીતિના અન્ય નરને પડકારે છે. બે નર શોભિંગ વચ્ચેની મુઠલેડ (પાન રહ, ‘વિહંગ’ સંનંગ અંક ૨૮)પણ આ પ્રકારની હોઈ શકે.

વિનોદ સી. સોની

જીવવિજ્ઞાન વિભાગ, સૌશાખ્ય યુનિવર્સિટી, ચાંદ્રોંગ્ડેન, ગાંધીશ્વરાંની, માલવ વરંધ પાછળી, જલારામ-૨, યુનિ. રોડ, રાજકોટ ૩૬૦૦૦૫

### ■ સારસ-સંરક્ષણ

‘વિહંગ’ સાચા અર્થમાં પક્ષીનિરીક્ષકો વચ્ચે

‘સેતુ’ બનેલ છે. મદદનીશ વનસ્પતિક, નળસરોવર તરીકેની ફરજ દરમ્યાન મને નળસરોવર અને થોળ બંને પક્ષી અભયારણ્યોના ‘મેનેજમેન્ટ પ્લાન’ લખવાની તક મળી હતી. બંને પક્ષી અભયારણ્યોની આસપાસના સાંશેદ, બાવળા અને કરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સારસ’ની સંખ્યા વિશેષ હોવાથી ભાઈ શ્રી કંદર્દ કાથજૂની પ્રેરણાથી ‘સારસ સંરક્ષણ’ ઉપર બંને પ્રોજેક્ટ પ્લાનમાં એક ખાસ ચેપ્ટર ઉમેર્યું. તેમાં સારસના પ્રજનનની સંપૂર્ણ પ્રક્રિયા તથા બચ્યાંઉછેર સુધી તેનું સતત ઘણ રાખ્યો, નિરીક્ષણ કરનાર વ્યક્તિને સામાન્ય નાણાંકીય વળતરની જોગવાઈ કરવામાં આવી છે. તેના ભાગઝે નળસરોવર પેટા વનવિભાગ, સાંશેદ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી કામગીરી શરૂ થઈ છે. આ કામગીરીમાં પોતાના વિસ્તારોના સારસસંરક્ષણ અને નિરીક્ષણની કામગીરી કરતાં સર્વશ્રી દેશણ પગી, વિકમ પગી અને કંદર્દ કાથજૂની ‘રિસોર્ટ પર્સન્સ’ તરીકે સેવાઓ લીધી છે. નવા નિશાળિયા તરીકે સાંશેદ અને તેની આસપાસના ગામોના સર્વશ્રી નરેશ જાદવ, ભીખાભાઈ ખત્રી તથા ભોજાજ આ કામગીરીમાં જોડાયા છે. મને જણાવતાં આનંદ થાય છે કે, સરેરાશ ૮૦ થી ૧૦૦ સારસના માળાની સંપૂર્ણ વિગતો જેવી કે સ્થળ, માળા બનાવવાનો સમય, પ્રથમ તથા બીજા ઈડાં મૂકવાની તારીખો, ઈડાં સેવનની તારીખો અને ત્યાર બાદ, બચ્યાંઉછેરની સંપૂર્ણ વિગતો હવે મળે છે. આ કામગીરીથી ધોળકા, બાવળા, સાંશેદ અને કરી તાલુકાનાં ગામોમાં સારસસંરક્ષણ વિષે સ્થાનિક ગ્રામજનોમાં વિશેષ જગૃતિ ફેલાઈ છે. ઓક્ટોબર, ૨૦૦૪માં વન્યપ્રાણી ઉજવડીના ભાગ રૂપે, અમદાવાદ ‘વનચેતના કેન્દ્ર’ ખાતે આ વિસ્તારોનાં પેડૂટોને આમંત્રિત કરી ‘સારસ સંરક્ષણ લોકભાગીદારી ઉજાગર’ કાર્યક્રમ હેઠળ તેઓનું અમિતવાદન કરી, તેઓને સ્મૃતિચિહ્નો અર્પણ કર્યા હતા.

પક્ષીસંરક્ષણના મારા આ મર્યાદિત અનુભવ ઉપરથી હું જે નિષ્ઠ ઉપર પહોંચ્યો હું તદ્વાનુસાર પક્ષીનિરીક્ષક મિત્રોને ‘વિહંગ’ના માધ્યમથી નીચે મુજબ ‘અપીલ’ કરું છું.

પક્ષીનિરીક્ષણ માટે તમામ ભિન્નો નિયમિત પોતાની આસપાસના અંતરિયાળ ગ્રામ્યવિસ્તારોની મુલાકાતે જતાં હોય છે. જ્યારે 'બાઈનોક્ક્યુલર'થી પક્ષીનિરીક્ષણ કરતા હોવ ત્યારે ગ્રામજનો ખૂબ જ કુતુહલવશ આપને જોતાં હોય છે. મોટે ભાગે 'બાઈનોક્ક્યુલર'ને કેમેરા સમજી ફોટોગ્રાફી થઈ રહી છે, તેમ માને છે. પરંતુ આપનું સાધન કેમેરા નહિ પરંતુ અત્યંત દૂરની વસ્તુ નજીક બતાવે તેવું 'બાઈનોક્ક્યુલર' છે, તેવું સમજીવી તેને 'બાઈનોક્ક્યુલર'થી જોવાનો લાલો આપશો તો તે ખૂબ જ આનંદિત થઈ ઊંઠે.

વગડામાં હિવસરાત ફરનાર ગ્રામજનોમાં પક્ષીઓ વિશે રસ જાગૃત કરીને તેને સાચા અર્થમાં તે ગામ માટે તમારા 'રિસોર્સ પર્સન્સ' બનાવવાનો આ ક્રિમિયો છે: આપના થકી આજુબાજુનાં ગામોમાં આવા 'રિસોર્સ પર્સન્સ'ની સંખ્યા વધારવાથી આપની જાણકારીના ઝોતમાં અનેકગણો વધારો થશે અને આપનું 'મોનીટરિંગ' વધુ

વ્યાપક બનશે. 'રિસોર્સ પર્સન્સ'ને પણ આપના દ્વારા પ્રોત્સાહન અને માન્યતા મળવાથી બીજા અનેક આ કામગીરીમાં જોડાશે. અને આમ થવાથી આપનો પાયો વિસ્તૃત બનશે. પરિણામ સ્વરૂપે આપ આપના વિસ્તારોનાં પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રશ્નોને જાણી તેના સમાધાન માટે ઢોસ ઉપાયો વિચારી શકશો અને આપનું અમૂલ્ય યોગદાન પણ આપી શકશો. ગુજરાતમાં પક્ષીનિરીક્ષણને પક્ષીસંરક્ષણ અને સંવર્ધનમાં પરિવર્તિત કરવાનો સમય પાડી ગયો છે. 'ગીધસંરક્ષણ અને સંવર્ધન' એ આપણા સૌ માટે પડકાર છે. ઉપરોક્ત કામગીરીમાં તેને પ્રાધાન્ય આપી શકાય.

શેતાંક જે. પંડીત

મદદનીશ વનસંરક્ષક, ટીએ, ગાંધીનગર  
૧૬, ઉપાદીમ સો., જીલ્લી રેસ્ટોરન્ટ સામે, અમદાવાદ-૩૮૦૦૧૫



## પ્રાણી સંગ્રહાલયમાં ચમચા અને પીળીચાંચ ઢોંકના

### પ્રજનનનો અહેવાલ

ભારત ખૂબ જ વિવિધતા ધરાવતી પક્ષીઓની જાતિઓનું રહેઠાણ છે. વિશ્વની કુલ પક્ષીજાતિઓમાંથી ૧૩ ટકા જેટલી ભારતમાં જોવા મળે છે. તેમાં ૧૪૧ જેટલી પ્રચલિત જાતિઓનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થાય કે પૂરા વિશ્વમાં જોવા મળતી પક્ષીઓની ૮૬૫૦ જાતિઓમાંથી લગભગ ૮૦૦ જાતિઓ ભારતમાં જોવા મળે છે (અલી અને રીલે - ૧૯૮૮). હાલમાં પક્ષીઓની ૭૮ જાતિઓ જોખમગ્રસ્ત છે, તેમાં આઈનો જોખમગ્રસ્ત (endangered) ની સૂચિમાં સમાવેશ થયેલો છે. આં બધામાંથી ગુલાબી માચાવાળી બટક અને ડિમાલાયન બટેર લગભગ લુમ જ છે. પક્ષીઓને લુમ થતાં રોકવા માટે આપણે જોખમગ્રસ્ત જાતિઓ વિશે વધુ સમજ મેળવવાની ખૂબ જરૂરિયાત છે. ગુજરાત ઈકોલોજિકલ કમિશને (૧૯૯૮) ૪૫૩ જાતિઓનાં પક્ષીઓની એક સૂચિ તૈયાર કરી છે, જેમાંથી ૬૫ ગુજરાતમાં જોવા મળે છે.

પીળીચાંચ ઢોંક (Painted Stork) અને ચમચો (Spoonbill) બંને પક્ષીઓ મહત્વનાં છે અને સામાન્ય રીતે પાણીની આસપાસ જોવા મળે છે. ચમચાનો સમાવેશ વન્યપ્રાણી સંરક્ષણ ધારાની સૂચિ-૧માં અને પીળીચાંચ ઢોંકનો સૂચિ-૪માં સમાવેશ થાય છે. ભારતમાં પીળીચાંચ ઢોંક અને ચમચાની પ્રજનન-વર્તિષુંકના અભ્યાસના ઘણા

અહેવાલ છે. ઇતાં પણ, તેઓના પાંજરામાં થયેલા પ્રજનનના અભ્યાસના કોઈ વિસ્તૃત અહેવાલ મળતા નથી. આથી પાંજરામાં આ પક્ષીઓના પ્રજનનની સફળતા અને પ્રજનનને અસર કરતાં પરિબળોનો અભ્યાસ કરવા માટેના અમારા પ્રયત્નો આ પક્ષીજાતિઓના સંરક્ષણ માટે અગત્યના સાભિત થઈ શકશે.

ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પક્ષીવિભાગમાં ઓગસ્ટ-૦૩ થી નવેમ્બર-૦૪ સુધીના અભ્યાસનું અહીં વર્ણન કરેલ છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પીળીચાંચ ઢોંક અને ચમચાનું પાંજરું ચારે બાજુ લોખંડની જાળીથી બનાવેલું છે. તેમાં વડનું જાડ અને વાંસ આવેલ છે. પક્ષીઓને માળા બાંધવા માટે લોખંડ અને જાળીનાં ગાજ 'લેટેકોર્મ' રાખવામાં આવ્યાં છે. એક પાણીનું તણાવ પણ પાંજરામાં છે. પાંજરાની એક બાજુએ સિમેન્ટની બનાવેલી 'ફિડીગ ટ્રે'માં પક્ષીઓને ખોરાક અપાય છે. પક્ષીઓને ખોરાક તરીકે ટીલાપીયા માછલી અને 'બીફ'નો ખીમો આપવામાં આવે છે. તેઓ પાંજરામાં રહેલાં વૃક્ષ અને બધારથી આપવામાં આવતી જાડની જાળીઓ અને પાંદડાની મદદથી સહેલાઈથી માળા બનાવી શકે છે. પીળીચાંચ ઢોંક અને ચમચાની સામાન્ય વર્તિષુંક ૧૫ મિનિટ સતત નિરીક્ષણ

બાદ ૧૫ મિનિટનો વિશામ આપીને નોંધવામાં આવી હતી. (બંનેની કેટલી જોડીઓ પાંજરામાં રાખવામાં આવેલ તે જણાવવું જરૂરી ગણાય. - લા.) પ્રાથમિક નિરીક્ષણમાં એવું જાણવા મળ્યું કે, પક્ષીઓ સવાર અને સાંજના સમય દરમ્યાન વધુ કાર્યરત હતા. આથી સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી હનો સમય નિરીક્ષણ નોંધવા માટે યોગ્ય જણાયો. અહીં ઉનાળાના સમય દરમ્યાન સરેરાશ તાપમાન ૪૭° સે. થી ૪૫° સે. એટલું અને શિયાળા દરમ્યાન આશરે ૭° સે. થી ૧૦° સે. એટલું રહેતું અને સરેરાશ વરસાઈ ૩૦-૪૦ ઈચ્છાની આસપાસનો હતો.

૧૬ માસમાં પીળીચાંચ ઢોક અને ચમચાના પ્રજનન અંગે, ચાર-ચાર માસના ચાર સમયગાળા દરમ્યાન નીચેની માહિતી પ્રાપ્ત થઈ.

પ્રથમ ચાર માસ (ઓગસ્ટ-૦૩ થી નવેમ્બર-૦૩)ના સમયગાળા દરમ્યાન આ મુજબની માહિતી પ્રાપ્ત થઈ. પીળીચાંચ ઢોકની એક જોડ દ્વારા એક ઈંદુ મૂકવામાં આવ્યું, જે માળામાંથી પડી જવાના કારણે તૂટી ગયું. ત્યાર પછીના સમયગાળા દરમ્યાન જોડી બનાવવાની વર્તણૂક પક્ષીઓ દ્વારા જવલે જ થતી જોવા મળી, જ્યારે ચમચાની જોડ દ્વારા કોઈ પણ જાતની પ્રજનન વર્તણૂક જોવા મળી નહીં. ચમચાની જોડી આખો દિવસ પ્રમાણમાં નિષ્ઠિક રહેતી. આ સમયગાળા દરમ્યાન પીળીચાંચ ઢોકનો ચમચા સાથે ઘણી વાર ઝડપો થતો. ચમચાના માળામાંથી ડાળીઓ લઈ જવાની પ્રવૃત્તિ આ દરમ્યાન સતત જોવા મળી.

ત્યાર બાદના ચાર મહિના (ડિસેમ્બર-૦૩ થી માર્ચ-૦૪) દરમ્યાન પીળીચાંચ ઢોકની જોડી દ્વારા એક પણ ઈંદુ મુકાયેલ ન હતું. આ મહિનાઓ દરમ્યાન પણ ચમચાના માળામાંથી ડાળી ચોરવાની પ્રવૃત્તિ ચાલુ રહી અને રહેઠાળની જગ્યા માટે અવારનવાર પીળીચાંચ ઢોક અને ચમચા વચ્ચે ઝડપો થતો. પીળીચાંચ ઢોકમાં આ સમયગાળા દરમ્યાન પણ જોડી બનાવવાની પ્રવૃત્તિ ખૂબ જ ઓછી રહી જ્યારે ચમચાની જોડી બની અને નર માદા બંને માળો બનાવવાની પ્રવૃત્તિમાં ભાગ લેતા. હ દિવસમાં માળો તૈયાર થઈ ગયો. આ સમયગાળાના અંતિમ ચરણમાં ચમચા દ્વારા જ ઈંડાં મૂકવામાં આવ્યાં. ઈંડાં મૂક્યા બાદ પણ માળામાં ઘણા સુધારાવધારા તો ચાલુ જ રહ્યા. મૂકવામાં આવેલા ચાર ઈંડામાંથી બે ઈંડાંનું સફળ રીતે સેવન થયું અને બંને ઈંડાં ફલિત થયા, જ્યારે બાકીનાં બે ઈંડાં અફલિત રહ્યાં. જે બે ઈંડાં ફલિત થયાં તેમાંથી એક

બચ્યું જાયું, જ્યારે બીજું બચ્યું માળામાંથી પડી જવાથી મૃત્યુ પામ્યું. આ સમયગાળા દરમ્યાન પણ રહેઠાળ માટેનો સંદર્ભ તો ચાલુ જ હતો. પીળીચાંચ ઢોક, ચમચાને દરેક રીતે અડચણ પહોંચાડે છે, તેવું નિરીક્ષણ કરવામાં આવ્યું, તેથી એવું તારણ નીકળે છે કે પીળીચાંચ ઢોકની ડાંજરીમાં ચમચા અનુકૂલન સાથી શકે તેમ નથી. આથી એવું વિચારવામાં આવ્યું કે, ચમચાને પીળીચાંચ ઢોકથી અલગ બીજા પાંજરામાં રાખવા જોઈએ.

એપ્રિલ-૦૪ થી જુલાઈ-૦૪ દરમ્યાન પણ પીળીચાંચ ઢોકની તેની જ જ્ઞાતિનાં બીજાં પક્ષીઓ સાથે લાડાઈ ચાલુ જ રહી. ચમચાના માળામાંથી ડાળીઓ ચોરી જવાની પ્રવૃત્તિ પણ આ સમયગાળા દરમ્યાન ચાલુ જ રહી, જ્યારે જોડી બનાવવાની વર્તણૂક અને પક્ષીઓની સક્રિયતા ખૂબ જ ઓછી જોવા મળી. આગળના મહિનામાં જીવિત રહેલું ચમચાનું એક બચ્યું નબળાઈને કારણે મૃત્યુ પામ્યું. ત્યાર બાદ ચમચાની જોડીને બાજુના પાંજરામાં ખસેડવામાં આવી. ત્યાં ચમચાની જોડી દ્વારા ઈંડાં મૂકવામાં આવ્યા જેનું સેવન કરવામાં આવતું. પરંતુ, થોડા થોડા સમયના અંતરે ગરો ઈંડાં માળામાંથી સરી જવાના કારણે તૂટી ગયા. છતાં પણ આ જગ્યા ચમચા માટે આદર્શ હતી. કારણ કે તેની બીજા કોઈ પક્ષી સાથે માળો બનાવવા માટે સ્પર્ધા ન હતી. ફક્ત એટલું જ કે, ચમચા પોતાના ઈંડાને માળામાંથી સરકીને નીચે પડી જતા રોકવા માટે સંશેષ ન હતા. શરદ્યાત્માં આવું થવાનું કારણે એ લાગતું હતું કે પક્ષીઓને માળો બનાવવા માટે પૂરતી ડાળીઓને અભાવ છે. પરંતુ પાછળથી એવું લાગ્યું કે કૃત્રિમ માળામાં સુધારો જરૂરી છે. કૃત્રિમ માળાની દિવાલ ચાર ઈંચ હોવી જોઈએ જેથી ઈંડાં કે બચ્યાં માળામાંથી પડી ન જાય. આવો ફેરફાર કરવામાં આવ્યો.

ઓગસ્ટ-૦૪ થી નવેમ્બર-૦૪ દરમ્યાન પીળીચાંચ ઢોકની બે જોડ દ્વારા માળો બનાવવાની પ્રવૃત્તિ સારી એવી માત્રામાં જોવા મળી. પક્ષીઓની એક જોડ દ્વારા બે ઈંડાં મૂકવામાં આવ્યાં. તેમાંથી એક ઈંડું ફલિત થઈ શક્યું નહીં અને તે નર અને માદા દ્વારા માળામાંથી ફેરફાર દેવામાં આવ્યું. બીજું ઈંડું ફલિત થયું અને તેમાંથી તંહુરસ્ત બચ્યું બહાર આવ્યું, જે સમયગાળાના અંત સુધી જીવિત રહ્યું. પીળીચાંચ ઢોકની જ બીજા જોડ દ્વારા પણ એક ઈંડું મૂકવામાં આવ્યું જે ફલિત થઈ શક્યું નહીં. ચમચાના કૃત્રિમ માળામાં સુધારો અને નવી જગ્યા તેઓના પ્રજનન માટે આદર્શ સાબિત થઈ.

## પ્રજનનનો હેવાલ

પકીઓની જોડ દ્વારા ત્રણ ઈંડા મૂકવામાં આવ્યા અને ૨૬ ટિવસ સુધી સેવન કરવામાં આવ્યું. બધાં ઈંડાનું સેવન પણ બરાબર થયું અને ત્રણ બચ્ચાં આજે પણ જીવિત છે.

પીળીચાંચ ઢોંક કરતાં ચમચા ઓછા સક્રિય અને ભળતાવા તથા શાંત અને ઓછા આક્રમક સ્વભાવના દોષ છે. કુદરતી વાતાવરણમાં પીળીચાંચ ઢોંક અને ચમચા એક સાથે જ માળા બાંધતા હોવાથી શરૂઆતમાં બંને જાતના પકીઓને એક જ પાંજરામાં રાખવામાં આવ્યા. પરંતુ આ પ્રયોગ અસફળ રહ્યો, કારણ કે બંને જાતનાં પકીઓ વચ્ચે રહેઠાણ માટે અવાર-નવાર સંવર્ધ થયા કરતો અને પકીઓ માળો બનાવવા માટે યોગ્ય જગ્યા પસંદ ન કરી શકતાં હોવાથી પ્રજનન અસફળ રહ્યું. આ માહિતી પરથી એવું તારણ નીકળ્યું કે, બંને જાતનાં પકીઓને અલગ-અલગ પાંજરામાં રાખવા જોઈએ અને પરિણામે ચમચાને બાજુના પાંજરામાં મૂકવામાં આવ્યા. આ ફેરફાર પકીઓના પ્રજનન સંદર્ભે ખૂબ જ સફળ રહ્યો. બંને નર અને માદા પકીઓ દ્વારા માળો બનાવવાની પ્રવૃત્તિ અને ઈંડાને સેવવાની પ્રવૃત્તિ પણ જોવા મળી. ઈંડાને સેવવાની પ્રક્રિયા દરમ્યાન પણ પકીઓ દ્વારા માળામાં વધારે ને વધારે ડાળીઓનો ઉમેરો થતો. આ સાથે જ પીળીચાંચ ઢોંકની એક જોડ દ્વારા પણ કૂનિમ માળા પર ડાળીઓ ગોઠવીને માળો બનાવવાની

શરૂઆત કરવામાં આવી અને બીજી જોડ દ્વારા પાંજરામાં ચાવેલ ઝડપ પર માળો બનાવવામાં આવ્યો. ઝડપ પર બનાવેલ માળામાં મૂકવામાં આવેલ ઈંડું ફિલિત થયું અને તેમાંથી બચ્યું બહાર આવ્યું જગ્યારે કૂનિમ માળામાંથી ઈંડા કરીથી નીચે પડી ગયા અને તૂટી ગયા. આ છક્કિતને ઘ્યાનમાં રાખીને કૂનિમ માળાના પરિમાણમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો અને ત્યાર બાદના પ્રજનનનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું, જે ઓગસ્ટ-૦૪ થી નવેમ્બર-૦૪ દરમ્યાન નોંધવામાં આવ્યું.

આમ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ ધારાની સૂચિ-૧માં સમાવિષ્ટ એવા ચમચા અને સૂચિ-૪માં સમાવિષ્ટ એવા પીળીચાંચ ઢોંકનોં પાંજરામાં પ્રજનનનો આ અહેવાલ ખરેખર પકીએમીઓ અને સંશોધનકર્તા માટે ખૂબ મહત્વનો સાભિત થઈ શકે તેમ છે.

એસ.એચ.બીમાણી, જે.એન.બૂચ, પી.એસ.ખાનપરા  
દેવતગિરિ નેચર કલબ, જૂનાગઢ  
ડૉ.માર.લી.ફેરફાર  
પ્રાણીશાખ વિભાગ, એમ.એસ.યુનિ.વડોદરા  
આર.ડી.કટારા  
જૂઅધિકારી, સક્કરબાગ જૂ, જૂનાગઢ



## મહારાજા શ્રી જામસાહેબનો પક્ષીપ્રેમ - પ્રાણીપ્રેમ

જ્યાપાલસિંહ જોડેજ

જુલાઈ, ૨૦૦૪ના પ્રથમ અઠવાડિયાની એક સાંજે ડૉ. નિલમબેન શારડાનો મારા પર ફોન આવ્યો કે, પૂ. જામસાહેબના જૂના મોટર હાઉસ પાસેની પાર્ક એવન્યુ સોસાયટીમાં, તેમના કર્માંનું મોરનાં ત્રણ બચ્ચાં બગ્યાચામાં સંતાયા છે અને બાકીનાં બે બચ્ચાને ફૂતરાં મારીને ખાઈ ગયા છે. હું સાંજે ૬-૩૦ વાગ્યે ત્યાં તાત્કાલિક ગયો અને મારી સાથે શ્રી કૃષ્ણાલ થાનકીને લઈ ગયો. ત્યાં બચ્ચાં, નાનાં વૃક્ષોની ઓથે સંતાયા હતાં અને તેમને પકડતાં લાગ્યું કે તે ટિવસે જ ઈંડા (hatching) માંથી બહાર આવ્યા હતો. હવે શું કરવું? તરત જ મેં પૂ. જામસાહેબ શ્રી શનુશલ્યસિંહજીને ફોન કર્યો કે આવું થયું છે. તેમણે કહ્યું કે, “તમે બચ્ચાને તેની મા સાથે ફરી મેળવવાની કોશિશ કરો.” અમે પ્રયત્ન કર્યા પણ તેની મા મોટર હાઉસની છત પર ફરીને બચ્ચાં માટે અવાજ કરતી હતી, પણ નીચે

આવતી ન હતી. હવે અંધારું થવા આવ્યું. ફરી પૂ. જામસાહેબને ફોન કર્યો એટલે તેમણે કહ્યું કે “હવે તો તમારે તેની મા બની દેખરેખ રાખવી પડશે અને આજે તમારે ત્યાં લઈ જાઓ.” મારે વેર પાંજરામાં તેમને રાખ્યા, ત્યાં એક કલાકમાં પૂ. જામસાહેબને ત્યાંથી ગાડી આવી અને ફ્રાઇચર એક ટીફીન લાવ્યો. મેં પૂછ્યું, “શું છે આ?” તેણે કહ્યું, “ટોગો છે, અને બાપુએ મોરનાં બચ્ચાં માટે મોકલાવ્યો છે.” અમુક જાતના લોટ, કોશમીર વગેરેનું મિશ્રણ લાગ્યું, પણ જેવું પાંજરામાં નાંખ્યું કે ફિટાફટ ત્રણીય બચ્ચાં ટોગો જમવા ટૂટી પડ્યા. મેં પૂ. બાપુને આભાર વ્યક્ત કરતો ફોન કરી બીજા ટિવસે મારે શું કરવું? અથવા તેને માટે ટોગો કેમ બનાવવો? તે અગે પૂછ્યું. તેમણે ફરમાવ્યું કે, “તમે તેની વિંતા ન કરો, મારે ત્યાં પ્રાણી (કાળિયાર, નીલગાય, સસલાં) માટે તથા પકીઓ (Great Indian

Hornbill, માડાગાસ્કર તથા કોસ્ટારિકાના મોટા પેરાકીટ, કબૂતર, જંગલ મેના) વગેરે માટેનું જૂદું રસોડું છે અને તેમાં મોરનાં બચ્ચાં માટે બની જશે! તમે કોશિશ કરો કે કૂડક કૂકડી (domestic hen) સાથે તેનો મેળાપ થાય, તો તેને મોટા કરી દે.”

મેં જામનગર મુનિ. સંચાલિત માધ્યલીધર ખાતેના ચિહ્નિયાધરમાં કૂકડીની તપાસ કરી તો તેનાં પોતાનાં બચ્ચાં મોટાં હતાં અને આ તાજાં બચ્ચાને મૂકું તો મોટાં બચ્ચાં કદાચ સ્પર્ધા થતા આને મારી નાંભે. આથી એક મોટું પિજંદું ખાલી કરાવ્યું જેમાં ક્યાંય દર ન હોય, જેમાંથી મોટાં ઊદરડાં આવી આ બચ્ચાને મારી ખાઈ ન જાય. ત્યાર બાદ નશેય બચ્ચાને મારે ત્યાંથી આ ચિહ્નિયાધરમાં લઈ જઈ ‘સેટ’ કર્યા. ત્યાંના સ્ટાફભાઈઓ સૂકું ઘાસ વગેરે લાવ્યા જેમાં તેને હુંસ રહે. આ અંગે પૂ. જામસાહેબને જાણ કરી તો તેમણે કહ્યું કે, “રોજ સવારે આ ત્રણેય બચ્ચાં માટે મારે ત્યાંથી ગાડી ‘ટોગો’ પહોંચાડશો. સાથે ચિહ્નિયાધરના સ્ટાફને કહેશો કે સાંજ પડ્યે તેમાં ફૂંગ થઈ જશે માટે વધેલો ટોગો ચિહ્નિયાખાનું બંધ કરતા પહેલા તેમના પાંજરામાંથી સાફ કરી ઉકરડામાં નાંભી દે, જેથી બચ્ચાં ખાઈ ન શકે.”

રોજ સવારે ૮ વાગ્યે પૂ. બાપુને ત્યાંથી મોરનાં બચ્ચાં માટે ‘ટોગો’ પહોંચાડવાનો કમ દોઢ મહિનો ચાલ્યો! આ દરમાન બચ્ચાના કદમ્બાં ખાસ્યો ફેરફાર નોંધાયો. પછી ફરી મારે તેમની સાથે મુલાકાત થઈ ત્યારે પૂ. જામસાહેબે જણાવ્યું કે, મારા એરિયામાં તેનાં જેવડાં ઘડાં સાથી બચ્ચાં છે, પણ આ મા વિનાનાં ફરતાં હોય તો ઘો (Monitor Lizard)નો એ વિસ્તારમાં ત્રાસ હોવાથી આ બચ્ચાને ખાઈ જાય. જો કે, હવે તો પોતાનું જતન કરી શકે તેવા થઈ ગયા હશે મારે ત્યાંના જુદા પાંજરામાં રાખીશ.

બીજા દિવસે આ ત્રણેય મોરનાં બચ્ચાને પૂ. બાપુનો સ્ટાફ આવી નાના પાંજરામાં નાંભીને લઈ ગયો અને પછી બે અઠવાડિયા પૂ. બાપુની દેખરેખમાં પાંજરામાં રાખી પછી વાલસુચાથી આગળ આવેલી રોજ માતાજીના મંદિર પાસે આવેલી વીડી વિસ્તારમાં કુદરતના ખોળે રમવા છોડી દીધાં!

તેમનો અદ્ભુત પક્ષી-માણીપ્રેમ જોઈ અમે તો છક્ક થઈ ગયા! ડિસે. ૨૦૦૪ ચિહ્નિયાધરમાં તેમના મહેલ વિસ્તારમાં રોજનો ૧૦ મણિ જાર પોપટ માટે નાંખતા. ત્યાર બાદ તેમણે મને કહ્યું કે, આ પક્ષીઓમાં ગજબનું કોમુનિકેશન, મેસેજ પાસ કરવાની સીસ્ટમ છે. તેમણે જણાવ્યું કે, ૨૦ દિવસ પહેલા ચાર ટીલિયા (Tuff) મારે તાં ઉત્તર્યા. બીજા દિવસે જમાંથી ૧૦ થયા, ગીજે દિવસે ૫૦ થયા, પછી ૧૦૦, ૪૦૦ અને પછી ૧૦૦૦ જેટલા ટીલિયા તેમના વિસ્તારમાં ખોરાક માટે જીતરતા હતા, જેના માટે રોજ ખોરાક નાંખવામાં આવતો. તેમના ચિહ્નિયાધરમાં ઈજાગ્રસ્ત રોજ (નીલગાય) તથા આંધણા ઘોડા, અંધે જાનવરોને નિભાવવા માટે જે સાચવણી છે તે ખરેખર તેમની જીવદ્યાની ભાવનાને સાર્થક કરે છે. પક્ષીઓ અંગેનું ઉંઘું જ્ઞાન, જાણકારી, વૈજ્ઞાનિક સમજ, પ્રાણીઓમાં જંગલી છે કે પાલતું વગેરેનું જ્ઞાન અને અનુભવનો તેમની પાસે અખૂટ ભંડાર છે. મેં તો એમની પાસેથી ખૂબ જ મેળવ્યું છે એ માટે હું મારી જતને સદ્ભાગી માનું હું. ખરેખર પૂ. જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી એક વાતસલ્યથી ભરપૂર મહારાજા ઉપરાંત કુદરત, પર્યાવરણનું અખૂટ જ્ઞાન ધરાવતી વિરલ વ્યક્તિ છે.

૮, પટેલ કોલોની, જામનગર ૩૬૧૦૦૮



## અડલી છ્યાં?

ચિરપરિચિત અને કદાચ એથી જ ઉપેક્ષિત એવું, મનુષ્યજીવન સાથે ઓતપોત થયેલું આ નાનકંદું પક્ષી અત્યારે એશિયાના ઈશાન ભાગમાંથી, વિષુવવૃત્તીય આંકિકામાંથી અને દક્ષિણ એશિયામાંથી વિલુપ્ત થઈ ગયું છે. ભારતમાં પણ ચકલીની વસ્તી દેખીતી રીતે જ ઓછી થઈ ગઈ છે, પરંતુ ગમે તે કારણોમાં આ ઘટનાને મંદ પ્રતિભાવ જ

મળ્યા છે. ચકલીની સંખ્યાની વ્યવસ્થિત નિરીક્ષણનોંધ બહુ ઓછા લોકો રાખે છે. ‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એશ્રીકલ્યરલ રીસર્ચ’ના સર્વેક્ષણ અનુસાર અંધ્રપ્રદેશમાં ચકલીની સંખ્યામાં ૮૦ પ્રતિશતનો ઘટાડો નોંધાયો છે. કેરલ, રાજ્યસ્થાન, ગુજરાત વગેરે અન્ય રાજ્યોમાં આ ઘટાડો ૨૦ પ્રતિશત જેટલો છે, પરંતુ દરિયાકાંદાના પ્રદેશોમાં ૭૦-

લેખક : મહમદ દિલાવર

ભાવાનુવાદ : નંદિતા મુનિ

## ચાહેરી છ્યાં?

૧૦ પ્રતિશતનો ઘટાડો થયો છે. આ એક ગંભીર પરિસ્થિતિ છે, એ કહેવાની જરૂર નથી.

આ કરુણિકા પાછળ એકાધિક કારણો જવાબદાર છે:

**૧. શિકાર:** કાગડા અને બિલાડી જેવા શિકારીની સંખ્યામાં વધારો થવાની અસર ચકલીની સંખ્યા પર પડી હોય તે શક્ય છે. (આપણી તરફ તો કાગડાની સંખ્યા ઘટથાના હેવાલ મળ્યા કરે છે. - લા.)

**૨. ખોરાકનો અભાવ:** ધરના આંગણામાં કે ઓટલા પર બેસી અનાજ સાફ કરવાની પ્રથા અત્યારે કેટલા ઘરમાં રહી હોય? 'પોલીથીન બેસ'માં 'હાઈજિનિક' રીતે પેક કરાયેલા ધાન્ય, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થોની લોકપ્રિયતા વધતી જાય છે, પરંતુ ચકલી માટે તો ખોરાકનો એક સ્નોટ ઘટ્યો જ - ધર અને બજાર બને સ્થળે.

**૩. પર્યાવરણ-સહદ્ય પેટ્રોલ:** 'ઈકો-ફેન્ડલી' લેબલવાળા 'અનલોડેડ પેટ્રોલ'માં એન્ટી-નોકારો એજન્ટ તરીકે 'મિથાઈલ ટર્શિયરી બ્યૂટાઈલ ઈથર' નામનું રસાયણ ઉમેરવામાં આવે છે. એના જવલનથી જંતુનાશક દ્રવ્ય ઉત્પત્ત થાય છે. આના કારણે ચૂસિયાં જીવડાં (એફિડ્સ) અને અન્ય જંતુઓની સંખ્યા ઘટી છે. ચકલીનાં બચ્યાંને આધી જરૂરી ખોરાક મળતો નથી.

**૪. ખેતીની પદ્ધતિમાં ફેરફાર:** 'હરિત કાન્ટી' બાદ ભારતમાં ખેતીની પદ્ધતિમાં મૂળગામી ફેરફાર થયા છે. આપણો દેશ અત્યારે વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં જંતુનાશકો અને ફૂત્રિમ ખાતરો વાપરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. આની અસરો સમજવી અધરી નથી.

**૫. બાળાયતની પદ્ધતિમાં ફેરફાર:** દેશી છોડ તથા લોનમાં દેશી ધાસના બદલે અત્યારે મૌખી વિદેશી જાતોનું ચલાણ વધ્યું છે. આ 'એક્ઝોટિક' વનસ્પતિને રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેની જરૂર પડે છે. પરિણામે ક્રિકેની સંખ્યા અને વૈવિધ્યમાં ઘટાડો થયો છે.

**૬. મકાનની બાંધણી:** પરંપરાગત મકાનોમાં મોખ-વળી-છાજાં-છાજલી-અભરાઈ-નળિયાં-જરૂરખા-ગોખલા, આવું ધણું ધણું રહેતું જ્યાં ચકલી અને અન્ય પ્રાણીઓ સલામતીપૂર્વક માળા બાંધી શકતાં. આ બધું તથા ધર ફરતા બાગ કે વાગેલિયા હવે જડપલેર લુમ થતાં જાય છે.

**૭. માઈકોવેવ પ્રદૂષણ:** 'મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન' માટેના ટાવર્સમાંથી એનેલોગ પ્રસારણ માટે ૬૦૦

મેગાહર્ટ્ઝ અને ડિજિટલ પ્રસારણ માટે ૧૮૦૦ મેગાહર્ટ્ઝના તરંગો પ્રસારિત થયા કરે છે. આ તરંગો તમામ સજીવોના ચેતાતંત્ર, તુધિરાભિસરણતંત્ર અને પ્રજનનતંત્ર પર ખરાબ પ્રભાવ પડે છે. આ વિશે પુષ્ટ સંશોધન થયું છે. આ પ્રદૂષણાના કારણે પક્ષીઓમાં 'માઈકોવેવ સિન્દ્રૂમ' નામે ઓળખાતી બિમારી જેવા મળે છે.

આપણે શું કરી શકીએ?

**૧. પર્યાવરણ-સહદ્ય બાગકામ.** આપણા બગ્યામાં (અને ખેતર હોય તો ખેતરમાં) કુદરતી સેન્દ્રિય ખાતરો વાપરવા. રાસાયણિક જંતુનાશકો ન વાપરવા. સજીવ ખેતીના ઉત્પાદનો બચરાદવાં. ક્રિકો પત્યે સહનશીલ બનવું. ચકલીને તથા અન્ય પક્ષીઓને ખોરાક, આશ્રય અને માળાની સગવડ મળી રહે તે માટે વિવિધ પ્રકારના દેશી છોડ તેમ જ વૃક્ષ વાવવા. વારાફરતી આપું વરસ કોઈ ને કોઈ જાતનાં ફળ, ફૂલ કે બીજ મળ્યા કરે તે રીતનું આયોજન કરી છોડ-વૃક્ષ વગેરે પસેદ કરવા.

**૨. માળાની સગવડ.** ચકલી સામાન્ય રીતે ઘરમાં, ઉપરાંત ઘાટા છોડવામાં કે વેલમાં માળો બનાવતી હોય છે. એને 'નેસ્ટબોક્સ' દ્વારા પણ અત્યારે આવશ્યક સહાય પૂરી પાડી શકાય. જૂતાના બોક્સ કે લાકડામાંથી નેસ્ટબોક્સ બનાવવા આસાન છે. માટ્લાની ઉપયોગ પણ કરી શકાય. ૨૮ x ૧૩ સેમીનું ૧૮ સેમી ઊંઠું અને ૩.૨ થી ૪ સેમીના વ્યાસનું ગોળ કાણું ધરવતું બોક્સ આદર્શ કહી શકાય. માળાના કારણે ઘરમાં થોડો કચરો પડે તો ચલાવી લેતાં પણ શીખવું.

**૩. ખોરાકની સગવડ.** ચકલીને મીઠાવાળો કે તૈલી ખોરાક, વાસી ખોરાક, બ્રેડ, અથવા આપી મગફળી, મકાઈ કે ઘઉંના દાઢા જેવી મોટા કદની વસ્તુઓ ન દેવી. એને એ સુપાચ્ય નથી અને ગળામાં ફસાવાનો ભય પડે રહે છે. એક વાર ખોરાક આપવાનું શરૂ કર્યા પછી બંધ ન કરવું એ અગત્યનું છે, કારણ કે પક્ષીઓ ખોરાકના આ સ્નોટ પર આધાર રાખતા થઈ જાય છે. સ્વચ્છ પાણીની વ્યવસ્થા પણ અવશ્ય કરવી, જેનો પક્ષીઓ પીવામાં તથા સ્નાનમાં પણ ઉપયોગ કરી શકે.

(ભાવાનુવાદ : 'હોનબિલ' એપ્રિલ-જૂન, ૨૦૦૬ : શ્રી મહેમાદ દિલાવરના લેખ પરથી સાભાર) નંદિતા મુનિ, ૩/૧, સેક્ટર ૪-એ, ગાંધીનગર-૩૮૨૦૦૪



## દરજાના માળાના થોડાંક અવલોકનો

ડૉ. પીયુષ પટેલ

### દરજાના માળાના થોડાંક અવલોકનો

તા. ૬-૬-૦૬ના રોજ મારા મૃક્તિપ્રેમી મિત્ર ડૉ. વિક્રમ પટેલ એક માળો ભેટ આપ્યો. પહેલી નજરે જ જ્યાલ આવી જાય એવો એ દરજાનાનો માળો હતો.

માળો સંપૂર્ણ સૂક્ષ્મ ગયેલ હતો. ડૉ. વિક્રમના કહેવા પ્રમાણે તા. ૧ અને ૨ જૂનના પવન સાથેના વરસાદથી માળો વૃક્ષ પરથી નીચે પરી ગયો હતો. આમ માળો મેના પાઇલા પખવાનિયા દરમિયાન તૈયાર થયો હોય એવું હું અનુમાન કરું છું.

પડેલા માળામાં લીલી જાંપવાળા કીમ રંગનાં રણા ઈડાં હતાં. આમ તો માળો અને ઈડાં નકામા થઈ ગયેલાં પણ છતાં ડૉ. વિક્રમે એને ફરી, એ જ જગ્યાએ બાંધી લટકાવ્યો. કદાચ માળાનાં પક્ષીઓ એને ફરી સ્વીકારે, ઈડાં સેવવાનો પ્રયત્ન કરે અથવા માળો ફરી ઉપયોગમાં લઈ શકે. પણ દરજાનું એ યુગલ ફરી ત્યાં ન દેખાયું.

સતત પવનને લીધે માળો ફરી ફરી પરી જતાં, માળો

મને ભેટ મળ્યો.


- માળો, ગુંડી વૃક્ષ પર, ફક્ત એક જ પાંદડામાંથી, આશરે પાંચેક ઝૂટની ઊચાઈએ બનાવેલ હતો.

રેખા ચિત્ર :


- ગુંડીના પરણનું માપ : ૧૪.૫ સે.મી. લંબાઈ  $\times$  ૧૪ સે.મી. પહોળાઈ.

- પાંદડાની ધારને દરજાએ નશ્ક લાવી, ધાર પર છિદ્રો પાડી, દરજ કે

મોચી મારે એવાં ટાંકા મારેલ હતા. બંને ધાર પર બાર બાર છિદ્રો હતાં. એક ધાર પર ઉપર ને સામેની બીજી ધાર પર નીચે, એમ 'અસમાન સ્તર' (Zigzag) બનાવીને દોરી પરોવી હતી. આપા માળામાં એક જ દોરી વાપરી હતી. દોરીમાં ક્યાં યે ગાંઠ નહોતી. ટાંકામાં, આપણે વાપરીએ છીએ એવો જ દોરો (સુતરનો) વાપર્યો હોય એવું અમારું અનુમાન છે. સંદર્ભમાં વનસ્પતિના રેસા કે તાંત્રા માટે જરૂરાવાયું છે.



(ગુંડીનું પણ્ણો)



ટાંકા લેવા માટે, બંને ધાર

પર લગભગ એક

મી. મી. ના વ્યાસવાળા,

બારબાર સુવ્યવસ્થિત છિદ્રો

હતાં. આ છિદ્રો પણ ધારથી

બરાબર બે કે ત્રણ

મીલીમીટરના અંતરે દોરા

મળેલ. એકેય ટાંકાથી પાંદડું

કે પાંદડાની ધાર ફાટેલ

નહોતા. ટાંકામાં એક જ

લાંબી દોરી એક છેદેથી બીજા

છેડા સુધી વાપરી હતી.

ઉપરના છેદે દોરીને મારી

જેવા પદાર્થ વડે છિદ્ર સાથે

ચોંટાડી દીધી હતી (ગાંઠ

નહોતી). દોરીનો અડધા

સે.મી. જેટલો છેડો,

છિદ્રમાંથી બદાર લટકતો

હતો. આમ બીજે છેદેથી

દોરી ખેંચવામાં આવે તો

પાંદડાની બંને ધાર નશ્ક

ખેંચાઈ આવે અને શંકુ

આકાર ધારણ કરી શકે એવી

વ્યવસ્થા હતી.

ઉપર અને

નીચેના બંને છેવાડે,

દોરીને છિદ્ર સાથે

ચોંટાડવા મારીની

અને/કેન્યાન્ય પદાર્થની

મિશ્રણવાળી 'પેસ્ટ'

બનાવી વાપરી હોય


એવું લાગ્યું. એ

ઉપરાંત, કેટલાંક

છિદ્રો પર પણ એવા જ

પદાર્થનો ગુંદર તરીકે

ઉપયોગ કર્યો હોય



એવું લાગ્યું.

આ રીતે દરજકામ પતી ગયા પછી, મુખ્ય/મૂળ માળો બનાવાયો હતો.

પાંડામાંથી બનાવેલ શંકુ આકારના માળામાં તણિયું, જુદી જુદી વસુસામચ્ચી વાપરી લગભગ ૨-૩ સે.મી. જરૂર બનાવ્યું હતું.

માળાની ચાર બાજુઓમાંથી, જે ખુલ્લી બાજુ હતી (જ્યાં ટાંકા મારી બંને ધાર ભેગી કરેલ) ત્યાં લગભગ એક સે.મી. જગાઈ વાળી દિવાલ કરી હતી. પાંદું બાકીની ત્રણ દિવાલનું કામ કર્યું હતું.

**માળાના આંતરિક માપ :**

- માળાની પાછળની પાંડાવાળી બાજુની લંબાઈ : ૧૦ સે.મી.
- માળાની આગળની (ટાંકાવાળી) બાજુની લંબાઈ : ૭ સે.મી.
- માળાના મુખ પાસે વ્યાસ : ૪.૫ સે.મી. x ૪.૦ સે.મી.
- માળાના તણિયા પાસે વ્યાસ : ૩.૫ સે.મી. x ૩.૦ સે.મી.
- માળાની ઊંડાઈ (મુખથી તણિયા સુધી) : ૭ સે.મી.

**મ.કુ.છિમતસિહળની કલમે.. અનુ. ટાઈટલ પેજ ઉથી..**

કે તેને પાંજરાંમાં રાખી તેમનું સંવર્ધન કરવું. આ રીતનું આપોજન ગીધ માટે કરવામાં આવ્યું છે. જે બચાં કૃત્રિમ રીતે ઊછરીને પુઝ વધનાં થાય તેમને છૂટાં કરી શકશે. આ ઉપાય બીજી જાતિનાં વિરલ પંખીઓને પણ લાગુ થઈ શકે. પરંતુ આની સાથે એ પણ જરૂરી છે કે, તેમના રહેવા માટેનાં જાડ કે ઘાસિઆ જમીનો અને તેમના પ્રજનન માટે ઉપયોગી એવાં બીજીં સ્થાનોને સાથે સાથે બચાવવાં. ગીધનો જ દાખલો આપું તો, હાલ કચ્છમાં તેમની સંખ્યા, રહેણાંકના સ્થાનો ઈત્યાદિ માટેના સર્વેક્ષણમાં જોવામાં આવ્યું કે અબડાસા તાલુકાના એકાદ ગામમાં સફેદપીઠ ગીધ (Whitebacked Vulture) જૂનાં અવાવરૂ ધરોનાં છાપરાં પર માળા બાંધે છે. સામાન્ય રીતે આ ગીધ જાડ પર માળા બાંધવાનું પસંદ કરે છે. હાલ વનવગડામાં, ગામડા તથા બગ્નિચાઓમાં વાપરક મ્રમાણમાં જાડ કાપી નંખાયા છે. તો આ ગીધને ભલે સફળતાપૂર્વક કૃત્રિમ રીતે ઉછેરીને છૂટા મૂકવામાં આવે પણ ત્યારે પ્રજનન ક્યાં કરશે,

- આમ સાત સે.મી.ની ઊંડાઈ ધરાવતા અને ૪-૪.૫ સે.મી.ના મુખવાળા શંકુ આકારના કપમાં માદા પક્ષી બેસતું કઈ રીતે હશે? - ડૉ. વિકમના કહેવા પ્રમાણે, પક્ષી માળામાં સીધું જઈ, અંદર ગુલાંટ મારી, પૂછડીને એકદમ સીધી ઊંચી કરી, ને આગળ માથું અને પાછળના ભાગે પૂછડી બદા રહે એ રીતે ઈંડા સેવવા બેસતું હતું.

માળામાં તણિયું અને એક દિવાલ બનાવવા વપરાપેલ વસ્તુ સામચ્ચી :

- કપાસનું રૂ
- વનસ્પતિના પર્ણના રેસા
- વનસ્પતિના છાલના તાંત્રણ
- ? નાળિયેરીના સૂકા તાંત્રણ
- મારી કે એના જેવો પદાર્થ ગુંદર તરીકે
- મારી/કાદવ/ખૂબ જ બારીક રેતી માળાના રૂના પડ ઉપર ચોટેલ હતી. (કદાચ રૂ સાથે આવી હોઈ શકે)
- શીમળાનું રૂ. અંદરનાં તણિયાનું ઉપરનું સ્તર શીમળાનાં રૂથી ભરેલું હતું, જે તણિયાને મુલાયમ, પોચું અને નરમ બનાવતું હતું.

એકસરે ડિસ્ટ્રિક્શનિક, અવી આર્કેડ, ટોક્ટર હાઉસ સામે, હાલર રોડ, વલસાડ



ક્યાં આરામ કરવા બેસશે યા રાતવાસો કરશે?

સંભળપૂર્વક, વૈજ્ઞાનિક રીતે બીજી લુભ થવાને આરે ઊભેલી પંખીઓની જાતિનું પણ સંવર્ધન કરી શકાય. પરંતુ તેમને છોઝાય બાદ તેઓ કુદરતમાં સ્થાપી થઈ શકે તે માટે પણ સાથોસાથ તકેદારી રાખવી અનિવાર્ય છે. ધોરાડ, ખડમોર અને બીજાં અસુક પંખીઓ ઘસ્તિયા જમીનોમાં રહેવાનું પસંદ કરે છે. તેમના બચાવની વ્યવસ્થા અને મનુષ્ય માટે તેના હિત માટેની વ્યવસ્થા પરસ્પર વિરોધી હોવી ન જોઈએ. પંખીઓનાં રહેઠાક્ષ અને મનુષ્યોની જેતી, તેમના પશુધન માટે ચરિયાં એ બંને ઉદ્દેશોનો વહેવારુ સમન્વય જરૂરી છે. પંખીઓના બચાવ માટેની યોજનામાં માણસોનો પૂરતો સહયોગ ન દોય તો તે આપોજન સફળ ન થઈ શકે. અને મનુષ્ય દ્વારા સહયોગ તો જ પ્રામણ થાય જો તેને પૂરતી ખાતરી થાય કે એ આપોજન તેના પણ હિતમાં છે.

જ્યુબીલી પ્રાઇન્ડ, ભુજ ૩૭૦૦૦૧



## મ. કુ. હિંમતકિશાહની છલમે

ગ્રામ અંકડી ચાલુ...

મારા પોતાના ઘર આંગણામાં જોવા મળતાં વિહંગોનો ઉલ્લેખ કરું તો જ્યારે આજથી પચાસ બાવન વર્ષ પૂર્વે મેં મારું મકાન બાંધું તે પછી અમુક વર્ષો સુધી (House Sparrow)ની એક બે જોડી નિયમિત રીતે મારા દિવાનખાનામાં અને જમવાના કશમાં પંખાઓ પર માળા બાંધતી અને કચરો કરતી. કાળજીમે તે આવતી બંધ થઈ. બાજુમાં આવેલ મારા નોકરોના મકાનોમાં લટકતી તસવીરો પાછળ અને બીજી જગ્યાઓ જેવી કે, ઘરના છાપરાં ઈત્યાદિમાં માળા બાંધતી. હવે આ પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ છે. હું નિયમિત રીતે માળામાંથી બહાર નીકળેલાં ચકલી(House Sparrow)નાં બચ્ચાને તેમના માબાપ પાસેથી ખોરાક માળાં જોતો, તે પણ હવે જોવામાં આવતાં નથી. ક્યારેક એકાદ એવા બચ્ચાને કાગડો પકડી પાડતો ત્યારે એ પક્ષીઓ સમૂહમાં ચી..ચી..ચી.. કરી કોલાહલ કરી મૂકૃતા. હવે ફક્ત એક ઊંઠ કેટલાં આ પક્ષીઓને હું મારા એક ફૂવાની આસપાસ જોઉં હું. નગરપાલિકાઓ દ્વારા ડી.ડી.ટી. ઈત્યાદિ રસાયણોનો છંટકાન થતો હોય છે, તેની ચકલી પર કેટલે અંશે અસર થતી હશે તે સંશોધનનો વિપ્યા છે.

ભુજમાં, પરતીકંપ બાદ હવે વધી વસાહતો વિકાસ પામી છે. મસંગોપાત્ર આવી એક વસાહતની મેં મુલાકાત લીધી ત્યારે, ત્યાં અગાઉ ઉગેલાં ગોરડ વગેરે ઝાડ મકાનો અને ખોટો વચ્ચે બચી ગેલાં મેં જોયાં. તેમાંના એક બે ઝાડ પર ચકલી (House Sparrow)ના સમૂહમાં બાંધિલ માળા જોયા ત્યારે આશર્થ થયું! ચોપાસ મકાનો હોવા છતાં એ પંખીઓએ ઝાડોને કેમ પરંદ કર્યા હશે, તે પ્રશ્ન મારા મનમાં ઉદ્ભબયો. હાલના આધુનિક બાંધણીના મકાનોમાં ચકલીને પરંદ પડે તેવી જગ્યાઓ નહીં હોય? મનમાં આવા અનેક ઉદ્ભબતા પ્રશ્નોનાં વમળો વચ્ચે હું તે જગ્યાએથી રવાના થયો.

ઉપર મેં ઉલ્લેખ કર્યો તે સ્થળ અગાઉ કચ્છના જૂના દેશી રાજ્યના સમયમાં એક વીડીનો ભાગ હતો. કચ્છમાં વીડીને ‘રખાલ’ તરીકે સંભોધવામાં આવે છે. આ રખાલ ‘નવી રખાલ’ તરીકે ઓળખાતી. તેમાં ઘાસ ઉપરાંત ગોરડ, ખીજડા, બોરડી તથા થોર ઈત્યાદિની ઝાડી હતી. આજાદી બાદ આ રખાલની મોટા ભાગની ઝાડી કાપી તેમાં બાજુના ગામનાં લોકો ખેતી કરવા લાગ્યા. ખેતીમાં સરળતા ન મળવાથી પા અન્ય બીજાં કારણોસર એ જમીન

એમ જ વર્ષો સુધી ખુલ્લી રહી.

આજુબાજુ છજુ પણ ઝાડી બચી ગઈ હતી જેમાં બુલબુલો (Babblers), ચંદ્રલ (Larks) ઈત્યાદિ ઘડી જાતનાં સ્થાનિક પંખીઓ જોવા મળતાં ખુલ્લી જમીન પર સને ૨૦૦૦ સુધી ટિટોડી (Redwattled Lapwing) અને વગાડાઉ ટિટોડી (Yellow-wattled Lapwing), બંને જાતોનાં હૃંડાં અને બચ્ચાં પણ જોવામાં આવતાં. ઉપરાંત, ભૌયચકલી (Ashy-crowned Finch Lark) અને તેતર (Grey Partridge) હું ત્યાં નિયમિત રીતે જોતો. હવે એ બધાં ભુજની ભાગોળમાંથી અદશ્ય થઈ ગયા છે અને જ્યાં નજર ઠરે ત્યાં ફક્ત ખુલ્લા ખ્લોટો અને સીમેન્ટ કોકીટના જંગલ જોવા મળે છે. આમ મનુષ્ય જાતિના વિકાસ અર્થે અને ભૂકૂપ પીડિતોના પુનઃવસન માટે જીવસૂચિ હતી તેને ત્યાંથી બહાર ઢકેલી દેવામાં આવી છે. આજે ફક્ત મારી વાડીમાં અને તેની આસપાસ તેતરને સાંભળું હું અને ક્યારેક ઝોઈ શકું હું. એ પણ હવે ચારે તરફ વસાહતોની વચ્ચે કેટલો વધારે સમય ટકી શકશે તે સવાલ છે.

હુલ્લે, કાગડા (House Crow) વિશે લખ્યું તો હું અગાઉ જણાવી ગયો હું તે મુજબ, ભુજની આસપાસ કાગડાની સંખ્યા સતત ઘટતી રહી છે. આ સાલ ફક્ત એક જ જોડી મારા મકાન પાસે જોઉં હું. તેણે હાલની મોસમમાં ત્રણ કોષલનાં બચ્ચાં ઉછેર્યાછે અને તેમને ખોરાક ખવડાવતા એ કાગડાને જોઉં હું. મને યાદ છે કે ભુજમાં કચ્છના મહારાઓનો શરદભાગ બગીચોછે તેમાં ઝાડ પર હજારોની સંખ્યામાં પોપટ (Rose-ringed Parakeet), કાબરો (Common Myna) અને કાગડા મોટાં વૃક્ષો પર દરેક મોરી સાંજે રાતવાસો કરવા આવતા. થોડા સમય અગાઉ હું ત્યાં સાંજે ગયો ત્યારે અંદાજે ૧૦૦-૨૦૦ કાગડા આવ્યા હશે. પોપટની સંખ્યા વિશે મને ખ્યાલ ન રહ્યો પરંતુ કાબરના કલબલાટ પરથી જણાયું કે તેની સંખ્યામાં કેરફાર નહીં થયો હોય. આ કાગડાનો ઉલ્લેખ એટલે કરું હું કે તેની સંખ્યા વિશે મારા જોવા બીજા પક્ષીનિરીક્ષકોને કચ્છમાં કે અન્યત્ર અનુભવ થયા છે કેમ, તે મારી દસ્તિએ રસમદ સવાલ છે.

કુદરતના ખોળે વિચરતાં વિહંગોની એવી જાતો જે લું થવાને આરે છે તેની પૂર્તિ કરવાનો એક ઉપાય એ છે


અનુ. પાના ૨૬૫૨..





ખીસ (Golden Oriole)

વિહાંગ પાર્ટીકુલર્સ  
અને રેન્ડિશન



... a benchmark of  
Quality, Purity & Trust!

An Exquisite Jewelry Mall from



Satellite, Ahmedabad

Exclusive Showrooms across 3 floors ...

Carats & Cents

Real Diamond Jewelry

Golden Attire

Gold & Antique Ornaments

Silver Ornates

Silver articles & Fashion Jewelry